


૩૦૦૮

નાના

શ્રી
કુલારીયાળ
 બદે
આરાસાણ



: લેખક :
શ્રી મથુરદાસ છગનલાલ શેડ



શ્રી કુંભારીયાજ તીર્થ

૩૬૫

1224

આગાસ્તણ.

૦૦

લેખક—

મધુરદામ છગનલાલ શેડ

વાગ શેરી, ભાવનગર.

સહાયક: ૩૦૦૮

શેડ પોચીલાલ હુંગરશીના. ટૂસ્ટના ટૂસ્ટનો
રતલાલ કેશવલાલ ચંદ્ર
વાડીલાલ કંગરુરી શાહ

૨૦૧૮



વિર સં. ૨૪૭૩] મૂલ્ય ૦-૬-૦ [વિકાસ સં. ૨૦૦૩

અનુક્લ મણિ કા

વિષય.

પૃષ્ઠ

૧ પ્રાચીન ઈતિહાસ	૨
૨ વિમળશાહ	૪
૩ શ્રી ધર્મદોપસ્તુરિ	૭
૪ વિમળનો ઉદ્ઘય	૯
૫ ધનપ્રાપ્તિ	૧૩
૬ આરાસણુ તીર્થ	૧૪
૭ દેરાસરો	૧૫
૮ મુસલમાની કાળમાં તુકસાન	૨૮
૯ તીર્થિયાર	૩૫
૧૦ જીર્ણિયાર	૩૬
૧૧ દાંતાલબનીગઢનું રાજ	૪૬
૧૨ અંખાળ માતાળ	૪૮
૧૩ આવવા-જવાના રસ્તા	૫૨
૧૪ દાંતાનું રાજ અને તીર્થ	૫૪
પરિશિષ્ટ ૧:	
૧૫ વાણિયાની ઉત્પત્તિ	૫૭
૧૬ નાવનો	૬૧

આન : પ્રિન્ટિંગ પ્રેસ : ભાવનગર,

નોંધોન

સરકારી નોકરીથી મેં મારો જીવનબ્યવહાર શરૂ કર્યો. લઘુ વર્પ પર્યાત સરકારી નોકરી કર્યા ખાહ એચ્યુટી લઈ મેં ગાંડ તથા ઉતેદીયા રોટોની સેવા બળવી. મારા ગુરુ મહારાજશ્રી પરમ પૂર્વ્ય યોગનષ્ઠ જૈનાચાર્ય શ્રી જુખ્સાગર સૂરિણના સંસગંગી ઉત્પન્ન થયેલ તીર્થ અને સંઘની સેવા કરવાની આવના થવાથી શોડ આણુંછુ કલ્યાણુણી પેઢીમાં સં. ૧૯૬૫ માં હું જોડાયો. અને મક્ષીજી (માળવા) તીર્થમાં મેં મારી સેવાની શરૂઆત કરી. લારભાદ સં. ૧૯૬૭માં હું કુંભારીયાજુ ગયો.

કુંભારીયાજુ ડેટલું મહાત્માજી ને પ્રાચીન તીર્થ છે તે તો. આ લઘુ પુસ્તિકા વાંચવાથી આપને જણાશે. કુંભારીયાજુ અંધારામાં પડેલું તીર્થ હતું. આ તીર્થની જહેરાતના અભાવે અંભાળ ને આણુ આવનારા બાત્રકો પડખામાં જ રહેલા આ કુંભારીયાજુ તીર્થની યાત્રાના લાભથી વંચિત રહેતા. મને આ વસ્તુ હદ્યમાં શાલ્યની માફુક ખટકવા લાગો મેં આ હિંદુમાં પ્રયાસ શરૂ કર્યો, પણ કુંભારીયાજુ સંબંધી વેભિત હુકીકત મને ન મળી.

મેં કુંભારીયાળું તીર્થના દુંગરોમાં અને આસપાસના વિસ્તારમાં ફરવાનું શરૂ કર્યું. વળી નજીકના ગામડાચોમાં પસ્તા લોકોના મુખથી હકીકિતે એકત્ર કરવા માંડી. વળી મારા જાણવામાં મહીકાંડા એજન્સીની ડિરેક્ટરી આવી. આ ઉપરાંત રસમાળા પણ મેં વાંચી જોઈ. આ ફરેક પ્રયાસને પરિણામે હું જે કંઈ હકીકિત પૂરાવાર્ડપે એકત્ર કરી શક્યે. તે મેં મારી મતિ મુજબ આ લઘુ પુસ્તિકામાં આપવાનો પ્રયાસ કર્યો છે.

હમેશાં લોકોક્રિત વૃત્તાંતના પ્રવાહમાં લણી જાય છે તેવું આ શ્રી કુંભારીયાળું તીર્થના સંબંધમાં પણ બન્ધું છે. આસપાસના દુંગરોમાં ને સ્થળોમાં જે કાટડા પડ્યો છે તેના નિરીક્ષણ પરથી મને જણાયું હે-ખનીજ કાઢી લીધા પછીનો ભડીનો જે કચરો નીકળેલો તેના હગલાઓ છે. આ કાટડા સંબંધી નૈનેતરે જુદી હકીકિત જણાવે છે, પણ તે અસત્ય ને જીંધે માગે દોરનારી છે.

મારા કુંભારીયાળુના વસવાટ દરમિયાન જે જે સાધુ-મુનિરાજે આવતા તે સર્વ તીર્થની પ્રાચીનતા જાણુવા માટે જિજ્ઞાસા ધરાવતા. આચાર્યાંશી વિજયયતીનદ્રસૂરિજી મહારાજના સંઘાડાના સાધુઓ કુંભારીયાળું આવેલા અને તેમાં મુનિશ્રી વિદ્યાવિજયજી આ બાધતમાં વધારે રસિક હોવાથી મેં તેમને ફેટલીક હકીકિત પૂરી યાડી અને તેઓએ કુંભારીયાળું, આખૂ, અચળાગઢ ને જીરાવતા પાર્થનાથની હકીકતની એક પુસ્તિકા સં. ૨૦૦૦ માં પ્રકાશિત કરી, પણ અત્યારે તે અલગ્ય છે.

બાદ મારી બાવનગરખાતે બદલી થતાં મેં આ વિષયને લગતા સાહિત્યનું વાંચન કર્યું. વળી જે જે વિગત મને મળી તે સર્વને આ પુસ્તિકામાં સમાવેશ કર્યો છે. દાંતાબવાનીગઢ

રાજ્યનો આ તીર્થ સાથે હાલ પૂરતો સંબંધ હોબાથી તેની ઐતિહાસિક હકીકત પણ આ ગુરુતકમાં આપી પુસ્તિકાને ઉપયોગી બનાવવા પ્રયાસ કર્યો છે. વાંચકો આ પુસ્તિકાને સાધંત વાંચી, કુંભારીયાળું તીર્થની યાત્રાનો લાલ દેવા પ્રેરાશે તો મારો શ્રમ સાથું થયો હું માનીશ.

આ પુસ્તિકાના પરિચિષ્ટદ્વારે “વાણીયાની ઉત્પત્તિ” સંબંધી હકીકત આપવામાં આવી છે, જે પણ રસિક ને જાણુવા જેવી છે.

આ યુગમાં દ્રોધસહાય વગર પ્રકાશન થઈ શકતું નથી. આ પુસ્તિકા પ્રગટ કરવા માટે પ્રાંતીજનિવાસી સ્વ. શેઠ પોચીલાલ હું ગરશીના દ્રષ્ટના દૃઢીએ શાહ રતિલાલ કેશવલાલ તેમજ શાહ વાડીલાલ હું ગરશીએ ઉદાર લાવે સહાયતા કરી છે, તે માટે હું તેમનો અણી છું. શેઠ પોચીલાલ હું ગરશી ધાર્નિંક વૃત્તિવાળા ગૃહસ્થ હતા એટા માટે તેમનું સંક્ષિપ્ત જીવનચરિત્ર આ પુસ્તિકામાં આપવામાં આવ્યું છે.

પ્રાંતે એટલું ધ્રચું હું કે-જે ને વાંચકો આ પુસ્તિકા વાંચે તંચો તીર્થ કુંભારીયાળુની યાત્રાનો અવશ્ય લાલ દે ને પાગાના સ્નેહીસંબંધીએને તેવી પ્રેરણ કરે. **॥ શાંતિ**

મથુરદાસ છગનલાલ શેઠ



શાહ પોચીલાલ દુંગરથીનો લુધનપરિચય

નાસ્તિ તેણાં યશઃકાયે જરામરણં ભયમ્ ॥

આપણી આ કાયા (ફેડ) આયુષની અવધિ પૂછું
થયે નાશ પામવાના સ્વભાવવાળી છે, પરંતુ યશરૂપી
કાયાને વૃદ્ધાવસ્થા તેમજ મરણનો ભય જ નથી, યશરૂપી
કાયા તો હુરહુમેશને માટે અમર જ છે. વિશાળકાય
તેમજ ગગનચુંણી જિનપ્રાસાહેના નિર્માતા આપણા
પૂર્વને આજે વિદ્યમાન નથી છતાં તેમના તે યશરૂપી
દેહે આજે પણ તેમના નામની ખેલ કુરકુરાવતા
તેઓ લુધંત હોવાની સાક્ષી પુરાવી રહ્યા છે. આ જગતમાં
તેઓનું લુધું જ સાથે ગણ્યાય છે.

પ્રાંતીજ ગુજરાતનું વ્યાપારી-ફોન છે. રેલવેનું
સાધન હોવાથી વ્યાપાર વિગેરેની સંગવડ રહે છે. પ્રાંતી-
જમાં દશાશ્વીમાળી મૂર્તિપૂજાક જૈન શોઠ દુંગરથીની
ધર્મપત્ની શળિયાત બાઈની પવિત્ર કુક્ષીમાં શ્રી પોચીલાલ-
બાઈનો જન્મ થયેદો. અખંશીમંત કુદુંખ હોવાથી લાડ-

કોડથી પોચીતાબાઇનો ઉછેર થયો. તે સમયમાં અંગ્રેઝ કેળવણી જિગતી દચામાં હતી. પોચીતાબાઇએ ગુજરાતી સંપૂર્ણ કેળવણી લીધી. તેઓ બાણ્યા કરતાં ગણ્યા વધારે હતા અને તેથી જ તેમની જુદ્દી સૌ કોધની પ્રશંસા માગી લેતી. તેમનો બાંધ્યા બેવડો, ગોળ મુખારવિંદ, સાખારષુ જિયાઈ અને ઘાટીલું શરીર હતું. સ્વભાવ પણ મળતાવડો, હસમુખો, ધાર્મિક વૃત્તિવાળો તેમજ શાંતિચાહક હતો.

પ્રાંતીજમાં દશાશ્રીમાળી વણિક કોમના પંચસો જેટલા ધરો છે. દશાશ્રીમાળી એટલે જુદા જુદા ધર્મોનો સમૂહ. કોઈ વૈષ્ણવ તો કોઈ સ્વામીનારાયણ, કોઈ મૂર્તિપૂજાક તો કોઈ સ્થાનકવાસી. આમ વિવિધ ધર્મો છતાં કન્યાની લેવડહેરડ અરસપરમ થતી. યોગ્ય ઉમરે પોચીતાબાઇનું લમ સ્વામીનારાયણ ધર્મ પાળ નાર ડેશાઈ પ્રભુદાખ ખીમચંદની પુત્રી વિજયા સાથે થયું. તેમનાથી તેમને એક પુત્રીની પ્રાસિ થયેલી. વિજયાના સરગંવાસ બાદ મૂર્તિપૂજક સંપ્રદાયમાં શાન્યુલાઈ ડેમચંદની પુત્રી શાંકુ બાયે ખીલુ વાં વિવાહ થયા.

તેઓ નાતના અશ્રેષ્ટ તરીકે કાર્ય સંભાળતા હતા અને તાહુકાના અમલદારો સાથે સારો પરિયય ડોવાથી ધર્મને લગતાં ખારાં કાચો થીશ્ર કરાવી શકતા. પોતે ગભંશીમંત હતા તેમજ નાણુાવટ(ધીરધાર)નો ધંધો કરતા એટલે તેમના સહચાખમાં અનેક લોકો આવતા અને

સૌ તેમના લોકસેવાના કાર્યમાં સહકાર આપતા, તેઓથી સંધળા શેડ હતા અને ખાર્મિંદ કાર્યોનો વહીવટ સુંદર રીતે ચલાવતા હતા.

એક કવિએ કહ્યું છે કે—

જિનેન્દ્રપૂજા ગુરુપર્યુપાસ્તિઃ સચ્ચાનુકમ્પા શુભપાત્રદાનમ् ।
ગુણાનુરાગઃ શ્રુતિરાગમસ્ય નૃજન્મવૃક્ષસ્ય ફલાન્યમૂનિ ॥

ભાવાથ- જિનેન્દ્રની પૂજા, શુરૂની ઉપાસના, પ્રાણિ માત્ર પર દ્વારા ભાવ, શુભ પાત્રમાં હાન, શુણીજન પર પ્રીતિ, આગમનું શ્રવણું—આ સર્વ મનુષ્યજન-મર્દુપ વૃક્ષનાં ઝેણો છે.

શેડ પોચીતાલભાઈમાં આ સંસ્કારે જીતયો હતા અને તેએ પોતાને માનવજનમ સર્કણ કરી ગયા. સામાયિક, પૂજા, ચૌદ નિયમ, વ્યાખ્યાનશ્રવણુ, શુરૂસેવા આ તેમના નિત્યનાં કાર્યો હતા. પ્રાતઃસમરણીય શ્રી રવિસાગરજ મહારાજ, શ્રી હીરસાગરજ મહારાજ તેમજ શ્રી કલ્યાણ-સાગરજ મહારાજ વિગેરે ધણાના પરિચયમાં તેઓ આઠ્યા હતા અને તેથી તેમના ધર્મ-સંસ્કાર વધારે દદ થયા હતા.

તેમને સંતતિમાં ઝડ્ઠા એ પુત્રીએ હતી, જે પૈકી એક બાદ્યાવસ્થામાં ગુજરી ગયેલ અને બીજી પુત્રી ભણ્યુ પ્રાંતીજનિવાસી ભાઈ મથુરહાસ (આ પુર્સિતકાના લેખક) સાથે પરલ્યાવવામાં આવી હતી. લગ્ન પ્રસંગે જૈનાચાર પ્રમાણે ઉજમણું કરી જૈન વિધિ મુજબ લગ્ન કર્યા હતા.

૧૯૧૦ માં પ્રાંતીજમાં ખેંગનો રોગ ક્રાણી નીકળ્યો। અને તે રોગ ઘણું જવોના બોઝ લીધેલા તેમાં આ કુદુંખનો પણ સમાવેશ થાય છે. લગ્ન કરેલ પુત્રી મહિલી આ ખેંગના રોગમાં સપડાઈને મૃત્યુ પામી. આ વર્ષની શરૂઆતમાં માતા રજિયાત પણ ગુજરી ગયા. તેમના કાકાના હીકરા ભણિવાલ પણ સપાટામાં આવી ગયા.

પોતાની માતા તેમજ પુત્રીના સ્વર્ગંવાસનો ધા રૂબાણો નહીં તેવામાં ૧૯૬૫માં તેમની પત્ની સાંકુ પણ ગુજરી જયા એટલે ચેઠ પોચીવાલભાઈને ધણો જ આઘાત લાગ્યો, તથીયત લથડના માંડી. છેવટે આશરે પીસ્તાલીશ વર્ષની વચે તેઓ પણ પોતાની પત્નીના સ્વર્ગંવાસ બાદ પંદર હિવસે, આશરે એક લાખ રૂપિયાનું દ્રસ્ટ કરી ક્રાગણ્ય શુદ્ધ હના રોજ સ્વર્ગંવાસી થયા.

દ્રસ્ટના દ્રસ્ટીઓ તરીકે તેમના કાકાના હીકરા શાહ કેશવલાલ ત્રીકમદાસ, અને શાહ ખુલાભીદાસ હાથીભાઈ વિગેર કાર્ય કરતા હતા. તેઓએ દ્રસ્ટી તરીકે પોતાનું કાર્ય સારી રીતે બનાવ્યું અને જેમ જેમ રક્ગ વસુવ આવતી અઈ તેમ તેમ દ્રસ્ટના ઉદ્દેશ અનુસાર તેનો વિષ કરવા લાગ્યા. ચાલીશ વર્ષથી આ દ્રસ્ટનો સારી રીતે અમલ અઈ રહ્યો છે, જે પ્રશાંસા ને ધન્યવાદને પાત્ર છે. ઉપરોક્ત દ્રસ્ટીઓ સ્વર્ગંવાસી થતાં દ્રસ્ટમાં વખ્યા પ્રમાણે હાવમાં શાહ રતિલાલ કેશવલાલ તેમજ શાહ વાડીલાલ કુંભરથી દ્રસ્ટની વ્યવસ્થા છે.

સ્વામીવાત્સલ્ય કે નોકારશી જેવા પ્રસંગે લોજનની વ્યવહથા કરવા માટે ધણી અગવડ પડતી. બાઈશ્રી રત્નિલાલના ખ્યાલમાં આ હકીકત આવતાં જ તેમણે શેહ પોચીલાલના દ્રદ્દમાંથી એક વાડી ખરીદી લઈ તે શ્રી સંઘને અર્પણું કરેલ છે, જેને હાજર લોજનાદિમાં સુંદર ઉપયોગ થઈ રહ્યો છે.

બાઈશ્રી રત્નિલાલ કેળવાચેત અને સંસ્કારી છે. પ્રાંતીજ ગ્રયનિસિપાલીટીના પ્રેસીડન્ટ તરીકે સોણ વર્ષ જેટલો લાંબો સમય લાગલાગઠ કામ કરી તેઓએ પોતાની કુનેહ દર્શાવી આપી છે. આમસુધારણું તેમજ માનવ રાહતના કાયો તેમની કાર્યવાહીને આભારી છે. પ્રાંતીજ હાઇસ્ક્યુલના ખીનરોપણુંમાં તેમનો જ સુખ્ય હિસ્સો હતો. તેમાં સ્વર્ગસ્થ પોચીલાલબાઈના નામથી હોલ ખંધાવી આપવામાં આવ્યો છે.

પ્રાંતીજ જેવા સ્થાનમાં આધુનિક ટ્રાન્સ્પોર્ટ પ્રસૂતિગૃહ નહોંતું અને તેથી કેટલીક વખત બહેનો જેખમકારક સ્થિતિમાં આવી પડતી. તે વખતે તેમનું જીવન ઝેક્ટા કુદરતની કુપા પર જ અવલંબતું. આ ખામી બાઈશ્રી રત્નિલાલના ખ્યાલમાં આવી અને તેમણે પોતાની સારી રકમ ભરી અને પ્રયાસ શરૂ કરી મહામહેનતે એક મેટરનીટી હોમ (પ્રસૂતિગૃહ) જીલું કચ્ચું જેને આજે દબારા લોકો આશીરોદ આપી રહ્યા છે. આ ઉપયોગી કાર્ય ઉપરાંત હાઇસ્ક્યુલ તેમજ સાર્જનિક બોર્ડિંગ પણ તેઓશ્રીના પ્રયાસને આભારી છે.

ભાઈશ્રી રત્નિલાલ કૃષ્ણ વ્યાપાર કે વ્યવહારકુશલ છે એટલું જ નહીં પણ ધર્મરસિક પણ છે. ચાલુ વર્ષના દ્રાગણ્ય માસમાં તેઓ (૩૫૦) સાડાત્રણસો યાત્રિકો સાથે શ્રી સિદ્ધાચળજીનો રેલ્વે-સ્ટેશને પ્રાંતીજથી સંઘ કાઢ્યો હતો. અને એ રીતે સંઘપતિનું માનવંતું બિરુદ્ધ પ્રાપ્ત કર્યું હતું.

ભાઈશ્રી રત્નિલાલના સહદ્રાસી ભાઈ વાડીલાલ કુમરશી પણ ઉત્સાહી છે. તેઓ પણ આ દ્રસ્ટદ્યવરથામાં ભાઈશ્રી રત્નિલાલને પોતાનો પૂરતો સહકાર આપી રહ્યા છે.

એવી આશા રાખવામાં આવે છે કે જે કુનેદથી તેઓ શેડ પોચીલાલભાઈના દ્રસ્ટની વ્યવસ્થા કરે છે તેવી જ રીતે ધર્મના કાચોમાં દ્રસ્ટની રકમનો સહૃદ્યય કર્યો કરે. પરમાત્મા તેમને આવા શુભ કાચો કરવા હીધોયુષ આપે.



શુદ્ધિ પત્રક

૫.	૫૬	અશુદ્ધ	શુદ્ધ
૧૭	૧૮	શાંતિ	શાંત
,,	૨૦	ઉપરની	ઉપર નીચે
,,	૨૧	આવી મૂર્તિઓ	આવી અંખાજી માતાનો મૂર્તિઓ।
૧૮	૧૨	હેરીઓમાં	હેરીઓ।
૧૮	૧૮	એ મૂર્તિઓ	એ મૂર્તિઓ। છે.
,,	૧૮-૧૯	તથા સરસ્વતોની એક મૂર્તિ એક હેરીમાં છે.	આ લાઇન કાઢી નાખવા અઃરસનો એક મૂર્તિ શ્રી સરસ્વતી દેવીનો છે.
,,	૨૧	કોતરેલાં છે.	કોતરેલાં છે. આ સિવાય અઃરસનો એક મૂર્તિ શ્રી
૨૦	૧૬	હેખાય	હેખાવ
૨૬	૩	છ તછે.	છત છે.
,,	૧૬	સૂર્ય યક્ષની	વિદુર્ય યક્ષનો
૩૦	૨૨	અદ્દાઉદીન દીદ્દો	દીદ્દો અદ્દાઉદીન
,,	,,	ત્યાં	ત્યારે
૩૨	૧૭	જનેતર	જનેતર
૪૧	૧૨	૧૯૬૦	૧૯૬૧ ના વૈશાખ શુદ્ધ ૧૦

શ્રી અધ્યાત્મજ્ઞાનપ્રેસારક મંડળ

સ્વ. શ્રીમહુ ભુદ્ધિસાગરસુરિજી અંથમાળામાં
પ્રગટ થયેલા અંથો

અંથાંક		પૂછ	કિલો
* ૧	અધ્યાત્મ વિખ્યાનમાળા.	૨૦૬	૦-૪-૦
* ૨	ભજનસંશ્રહ ભાગ ૨ નો.	૩૩૬	૦-૮-૦
* ૩	ભજનસંશ્રહ ભાગ ૩ નો.	૨૨૫	૦-૮-૦
* ૪	સમાધિથતકમુ.	૬૧૨	૦-૮-૦
* ૫	અનુભવપદ્ધિશો.	૨૪૮	૦-૮-૦
* ૬	આત્મપ્રદીપ.	૩૧૫	૦-૮-૦
* ૭	ભજનસંશ્રહ ભાગ ૪ થો.	૩૦૪	૦-૮-૦
૮	પરમાત્મદર્શિન.	૪૦૦	૦-૧૨-૦
૯	પરમાત્મજ્યોતિ આવૃત્તિ ૨	૫૦૦	૧-૮-૦
* ૧૦	તત્ત્વાંદુ.	૨૩૦	૦-૪-૦
૧૧	ગુણાનુરાગ (આવૃત્તિ બીજી)	૨૪	૦-૧-૦
* ૧૨-૧૩	ભજનસંશ્રહ ભાગ પમોતથા જાનદીપિકા. ૧૦૦	૦-૬-૦	
૧૪	તીર્થયાત્ર નું વિમાન (આ. ગ્રીજી)	૪૫૫	૪.
* ૧૫	અધ્યાત્મભજન સંશ્રહ.	૧૬૦	૦-૬-૦
૧૬	ગુરુઓથ (આ. બીજી)	૨૬૦	૦-૮-૦
૧૭	તત્ત્વજ્ઞાનદીપિકા. આ. ૨	૧૨૪	૦-૧૦૦
૧૮	ગહુંલીસંશ્રહ. આ. ૧ આ. ૨	૧૧૨	૦-૬-૦
૧૯-૨૦	આધ્યાત્મમંદિર્ય ભાગ ૧-૨	૪૦-૪૦	૦-૧-૦
* ૨૧	ભજનસંશ્રહ ભાગ ૬ ટૂ.	૨૦૮	૦-૧૨-૦
* ૨૨	વચનામૃત.	૧૩૦	૦-૧૪-૦
૨૩	યોગદીપક.	૩૦૮	૦-૧૪-૦
૨૪	નૈત ઔતિહાસિક રાસમાળા.	૩૦૮	૧-૦-૦

૨૫ આનંદધત્પદ (૧૦૮ સંચહ આ. ૨.)	૮૦૮	૩-૦-૦
૨૬ અંધ્યાત્મશર્ણાતિ (આવૃત્તિ ત્રીજી)	૧૩૨	૦-૩-૦
૨૭ કાળ્યસંચહ ભાગ ૭ મેં.	૧૬૬	૦-૮-૦
૨૮ જૈનધર્મની પ્રાચીન અને અર્વાચીન (સ્થિતિ દુદ્દ)	૬૬	૦-૧-૦
* ૨૯ કુમારપાલ (હિંદી)	૨૮૭	૦-૬-૦
૩૦ થી ૩૪ સુખસામરગુરુગીતા	૩૦૦	૦-૪-૦
૩૫ ષદ્ગ્રંથ્યવચ્ચાર આવૃત્તિ ૩	૨૪૦	૦-૪-૦
*+૩૬ વિજાપુર વૃત્તાંત.	૬૦	૦-૪-૦
✗ ૩૭ સાખરમતી ગુણુચ્છિક્ષણ કાળ્ય.	૧૬૨	૦-૬-૦
* ૩૮ પ્રતિશાપાલન.	૧૧૦	૦-૫-૦
૩૯-૪૦-૪૧ જૈનગચ્છમતપ્રભંધ, સંધપ્રગતિ, જૈનગીતા.	૩૦૪	૧-૦-૦
૪૨ જૈનધાતુપ્રતિમા લેખસંચહ ભા. ૧.		૧-૦-૦
* ૪૩ મિત્રમૈત્રી.	૧૭૦	૦-૮-૦
* ૪૪ શિષ્યોપ નષ્ટદ્દ.	૪૮	૦-૨-૦
૪૫ જૈનોપનિષદ્દ.	૪૮	૦-૨-૦
૪૬-૪૭ ધ્યાંમિક ગદ્યસંચહ તથા પત્ર સહૃપદેશ ભાગ ૧ લો.	૬૭૬	૩-૦-૦
૪૮ ભજનસંચહ ભા. ૮	૬૭૬	૩-૦-૦
- ૪૯ શ્રીમહે દેવચંદ્ર ભા. ૧ આ. ૨	૧૦૨૮	૨-૮-૦
- ૫૦ શ્રીમહે દેવચંદ્ર ભા. ૧ ના ચાર કડકા જુદા પાકા ખાંધેલા		૩-૦-૦
✗ ૫૧ કર્મચીઠા.	૧૦૧૨	૩-૦-૦
* ૫૨ આત્મતત્ત્વદર્શિન.	૧૧૨	૦-૧૦૦
+ ૫૩ ભારતસદકારશિક્ષણ કાળ્ય.	૧૬૮	૦-૧૦૦
૫૪ શ્રીમહે દેવચંદ્ર ભાગ ૨ આ. ૨	૧૨૦૦	૨-૮-૦
૫૫ ગહુંલી સંચહ ભા. ૨ આ. ૨	૧૩૦	૦-૬-૦

૫૪ ગહુંલી સંશેષ કા. ૧-૨ કોગા પાકા ખાંધિતા.	૦ ૧૨-૦
૫૫ કર્મપ્રકૃતિટીકા ભાષાંતર.	૩-૦-૦
૫૬ ગુરુગીત ગહુંલીસંશેષ.	૦.૧૨-૦
૫૭-૫૮ આગમસાર	૦-૬-૦
૫૯ ડેવચંદન સ્તુતિ સ્તવન સંશેષ.	૦-૪-૦
૬૦ પૂજાસંશેષ ભા. ૧ લો.	૧-૦-૦
૬૧ ભજનપદસંશેષ ભા. ૮	૧-૮-૦
૬૨ ભજનપદસંશેષ ભા. ૧૦	૧-૦-૦
૬૩ પત્રસદુપહેશ ભા. ૨	૧-૮-૦
૬૪ ધાતુપ્રતિમા લેખસંશેષ ભાગ ૨	૧-૦-૦
૬૫ જૈનદાદિઓ ધર્શાવાસયોપનિષદ લાવાથ' નિવેચન.	૧-૦-૦
૬૬ પૂજાસંશેષ ભાગ ૧-૨	૨-૦-૦
૬૭ સનાત્રપૂજા.	૦-૨-૦
૬૮ શ્રીમહ દેવચંદ્રજી અને તેમનું જીવનચરિત્ર	૦-૪-૦
૬૯-૭૨ શુદ્ધોપયોગ વિ સંસ્કૃત અંથ ૪	૦ ૧૨૦૦
૭૩-૭૭ સંધકર્તાબ્ય વિ સંસ્કૃત અંથ ૫	૦.૧૨-૦
૭૮ લાતા લજ્જપતરાય અને જૈનધમ'.	૦-૪-૦
૭૯ ચિન્તામંદ્ય	૦-૪-૦
૮૦-૮૧ જૈનધમ' અને ખ્રિસ્તી ધર્મનો મુકાબલો તથા જૈનખ્રિસ્તિ સંવાદ	૧-૦-૦
૮૨ સત્યસ્વરૂપ	૦-૬-૦
૮૩ ધ્યાનચિચાર.	૦-૮-૦
૮૪ આત્મશક્તિપ્રકાશ.	૦-૪-૦
૮૫ સાંવત્ಸરિક ક્ષમાપના	૦-૩-૦
૮૬ આત્મદર્થન (મહેશીયંદ્રજીકૃત સલજ યો॥) તુ નિવેચન.	૦-૪-૦
૮૭ જૈનધાર્મિક શંકાસમાપ્તાન.	૦-૨-૦

૮૮ કન્યાવિકુદ્ય નિષેધ.	૨૦૦	૦-૬-૦
૮૯ આત્મશિક્ષા ભાવનાપ્રકાશ.	૧૧૫	૦-૭-૦
૯૦ આત્મપ્રકાશ.	૫૬૫	૧-૮-૦
૯૧ શોકરિનાશક અંથ.	૮૦	૦-૧-૦
૯૨ તત્ત્વવિચાર.	૧૨૫	૦-૬-૦
૯૩-૯૭ અધ્યાત્મગીતા વિ. સંસ્કૃત અંથ.	૨૦૫	૧-૦-૦
૯૮ જૈનસૂત્રમાં ભૂતિપૂળ	૬૬	૦-૩-૦
૯૯ શ્રી યશોવિજયજી નિષેધ.	૨૧૦	૦-૬-૦
૧૦૦ લજ્જનપદસંથહ ભાગ ૧૧	૨૨૦	૦-૧૨-૦
૧૦૧ , , ભાગ ૧ આ. ૪ થી	૨૦૦	૦-૮-૦
૧૦૨ શુદ્ધરાત ખૃહૃદ વિજાપુર વૃત્તાંત.	૩૦૦	૧-૪-૦
૧૦૩-૧૦૪ શ્રીમહૃ દેવચંદ્રજી વિસ્તૃત જીવન-		
ચરિત્ર તથા દેવવિલાસ	૨૩૦	૦ ૧૨-૦
૧૦૫ મુદ્રિતજોન શ્વે. અંથગાધિક	૩૮૦	૧-૮૦૦
૧૦૬ કષ્ણાવલી-મુખોધ.	૪૬૦	૧-૪-૦
૧૦૭ રત્નવન સંથહ (દેવવંદન સહિત)	૨૭૫	૦-૧૦૦
૧૦૮ પત્ર સહૃપદેશ ભાગ ૩	૧૦૦	૦-૬-૦
૧૦૯ શ્રી ખુદ્ધિસાગરસૂરીધર સમારક અંથ (સચિત્ર)	૨૩૦	૦-૧૨-૦
૧૧૦ પ્રેમગીતા સંસ્કૃત અંથો અણવાનાં ઠેકાણાં :—		૦-૬-૦

अंथी भगवान् कुकाण्डः—

(૧) વકીલ મોહનલાલ હુમચંદ-પાટેરા

(२) श्रीमहाबुद्धिसागरसूरि लैन शानमंडिर-विळापुर (३. शु)

* આ નિશાનીવાલા અંથેા શિલ્પકમાં નથી.

* આ અંથે બિટિશ કેળવણીભાતાને મંજુર કરેલા છે.

+ આ અંથેા શ્રીમત ગાયકવાડ સરકારના ફેણવણી

ખાતાએ મંજુર કરેલા છે.

આરાસાણ

ખાને

તીર્થ કુંભારીયાજ

યદુવંશસમુદ્રેન્દુઃ, કર્મકષ્ટહુતાશનઃ ।

અરિષ્ટનેમિર્મગવાનુ, ભૂયાદુ વોડરિષ્ટનાશનઃ ॥

યદુવંશદ્વીપી સમુદ્રને વિધે ચંદ્ર સમાન, કર્મદ્વીપી વતને
દગ્ધ દરવામાં અજિન સમાન એવા લગવાન શ્રી અરિષ્ટનેમિ
(નેમિનાથ) તમારા અરિષ્ટો-દુઃખોના નાશને માટે થાઓ !

❖

❖

❖

કુન્દિન્દુગોક્ષીરતુસારવના, સરોજહત્થા કમલે નિસના ।

વાએસિરી પુત્યયકગહત્થા, સુહાય સા અમૃ સયા પસત્થા ॥

તોતરનું દૂષ, ચંદ્ર, ગાથનું દૂષ, બરરક્તના જેવા શ્વેત
વષ્ણવાળી, જેના (એક) હાથમાં કમળ છે તેવી તેમજ કમતને
વિધે બેઠેલી, (બીજા) હાથમાં પુસ્તકના સભૂવાળી એવી ઉત્તમ
શારદાહેવી (શ્રુતહેવતા) અમારા સુખને માટે થાઓ.

૧

માચીન દૃતિહાસ

ગુજરાતની ઉત્તરે આખૂ પર્વત ગુજરાતને મારવાડથી અલગ પાડે છે. તે આખૂ પર્વતથી દક્ષિણપૂર્વ દિશામાં આરાસાણુના પહોડો આવેલા છે. આખૂ પહોડથી દક્ષ ગાઉ હુર આરાસાણુના પહોડોની વચ્ચમાં પહેલાં આરાસાણુ નામે નગર હતું. તેમાં અઠારે જાતિના લોકો વસતા હતા. આ નગર ચંદ્રાવતીના રાજાઓના તાળામાં હતું. ચંદ્રાવતી નગરી, આખૂ પહોડની તળેટીમાં હતી. લાંના રાજાઓ આરાસાણુ ઉપર હુકુમત ચલાવતા હતા. આરાસાણુ નગરની ચારે બાજુ નાના મોટા પહોડ આવેલ હતા. તે વનરાજુથી ભરપૂર હતા. અસંખ્ય જાતિની ઔષધિઓ તેમાં થતી હતી અને હાલ પણ થાય છે. આ પહોડામાં ખનીજ ભરપૂર છે. નાનીમોટી નહીંઓ અને અરણું ખળળળ વહે છે. ચોમાસાના દિવસોમાં પર્વતો ઉપર જ્યારે વાદળાં જામે છે લારે જાણે બરકુ જામ્યો હોય તેવો સુંદર દેખાવ નજરે પડે છે. હવાપાણી ઉત્તમ છે. આ આરાસાણુ નગરની પચ્ચિમે પ્રખ્યાત શ્રી અંબાજી માતાનું દેંદેં છે. તે પ્રખ્યાત હોવાથી દેશનિદેશના ઘણું જગ્રાતું ત્યાં જગ્રાત કરવા આવે છે.

આરાસાણુ નગર પાસે ટેકરીઓની વચ્ચમાં ઝુલ્લું મેદાન છે. ત્યાં વડ, ભીપળા, આંખા, ખાખરા, ખંબુરી વગેરે વૃક્ષો પુષ્કળ છે. આ નગરને સુસલમાની વખતમાં વિ. સં. ૧૩૫૩ની સાતમાં અદ્દાઉદીનના લશ્છરે ઉજજડ કર્યું અને વર્તતી સ્થળાંતર કરી જવાથી નગરને સ્થાને જંગલ જેવું થઈ ગયું. ત્યારપણી

જ્યારે અકબર બાદશાહે મેવાડ ઉપર અઠાઈઓ કરી તે જમયમાં મેવાડમાંથી કોઈ કુંભો નામનો ગરાસીયો (કુંભા રાખ્યા નહીં) પોતાના ખરિવાર સાથે અહીં આવીને વસ્યો અને તેના નામ ઉપરથી ગામનું નામ કુંભારીયા પાડ્યું. અત્યારે પણ કુંભારીયા નામે પ્રસિદ્ધ છે. આ ગરાસીયાના વંશનો હાલમાં ટેકરીઓ ઉપર દૃટાંછવાયાં છાપરાં બાંધીને રહે છે. આ ગરાસીયા સીસોદીયા વંશના કહેવાય છે. આ લોકોના વહીવંચા ચાર પાંચ વરસે આવે છે અને તેઓના કથનથી આ વાતને ટેકો મલે છે. કુંભારીયાની આજુભાજુ બીજ ગામડાં છે તેમાં વચ્ચે ગરાસીયા લોકો રહે છે. આ પ્રદેશ અત્યારે દાંતા લવાનગઠ રાજની હકુમતમાં છે. આ લોકો અજ્ઞાની, વહેમી અને અનૂની છે.

આરાસાણુ નગર જૂનું હતું તે કીકિત જેણ ધર્મના
પ્રાચીન પુસ્તકોમાં ભળી આવે છે. જૂની તીર્થમાળાના
સ્તરનોમાં આરાસાણું તીર્થંતું નામ છે. રેમજ વિમળ
પ્રથંધમાં ખણું આરાસાણુ લખેલું છે. વળી આ તીર્થમાં
દેરાસરોમાં ભૂગનાયકની પ્રતિમાઓ અં. ૧૬૭૫ માં
દરી પ્રતિષ્ઠિત થયેલી છે. તેમાં આરાસાણુ નગર લખેલું છે.
જિનાલયોમાં દેરીએ ખાલી છે તેના પણ સણો ઉપર

૧. અમદાવાદથી નીકળતાં “ ક્રેન બમ્” સત્ય પ્રકાશ્”માં છે.
૨૦૦૦ની સાતમાં રાખુકપુર તીર્થનું વર્ષન છે તેમાં આરાસાખની
છીકા છે. વિમળપ્રથંખમાં પણ આરાસાખની છીકા છે. જુઓ, વિમળ-
પ્રથંખ ખડક ૪, ચોપાઈ ૭૦, ખડક ૬, ટેગ ૮, ખડક ૮ મો,
ચોપાઈ ૫૮)

૧૨, ૧૩, ૧૪ મા સકાના લેખ છે તેમાં પણ કોઈક જગાએ આરાસાણું નગરનો ઉલ્લેખ કરેલો છે. ધણુા લેખોમાં નગરનું નામ નથી. કે લેખો છે તે બધા ઉપરથી ચોક્કસ થાય છે કે અહીં આરાસાણું નામનું લંઘ નગર હતું અને પશ્ચિમ તરફ અંખાળ માતાજીનું સ્થાનક હતું.

વિમળશાહ

વિમળશાહ પોરવાડ^૧ વાણીએ હતા. તેમના વડવા શ્રીમાલનગરમાં રહેતા. તેમાં નીન મંત્રી નામે કોટિષ્વજ પુરુષ થયો.^૨ સંનેગવશાત્ તેમની સ્થિતિ નરમ થવાથી તે શ્રીમાળનગરથી ગુજરાતમાં ગાંભુ ગામે આવી વસ્યા ને પુરુષાર્થથી ખન મેળાયું.

સં. ૮૦૨ માં વનરાજ ચાવડાએ અખુહીલપુર પાટણ વસાંયું અને તેને રાજધાનીનું શહેર બનાયું. પાટણની પ્રખ્યાતિ ખાંકળી નીન મંત્રી પાટણ આવીને રદ્દા. તેના વંશમાં લહિર નામે પુરુષ થયો. તે ધણો

૧. પોરવાડ વાણીયા શી રીતે થયા તે હકીકત વિમળપ્રથંધમાં વિસ્તારપૂર્વક જણાવી છે. આ પુરતકના છેવટના ભાગમાં વાણીયાની ઉત્પત્તિની હકીકત ટૂંકમાં આપી છે.

૨. વિમળશાહ અને તેના વડવાઓની હકીકત, વિમળશાહની બધી હકીકત, વિમલપ્રથંધ, કે જૈન મુનિમહારાજ બાજ્યસુભય ગણ્ય ભડારાને સં. ૧૫૬૮ માં રચેલો છે તેમાં વિસ્તારથી આપી છે. તેમાંથી ટૂંકમાં અહીં જાણવા પૂરતો સારભાગ આપેલો છે. વિમળ મંત્રી સંઅંધી રસિક ને સંપૂર્ણ છતિહાષ જાણવાના જિયાસુએ “વિમલપ્રથંધ” વાંચવો.

હેંશિયાર અને શૂરવીર હોવાથી પાટથુનો દંડનાયક થયો. તેને વીર નામનો પુત્ર થયો. તેમને વીરમતી નામની પત્ની હતી. આ વીરમતીને એક દિવસ રાતે સ્વરૂપ આંધ્રું તેમાં તેણે હેવે આપેલાં કમળનાં કૂલથી શ્રી વિમળનાથ તીર્થીકરને પૂજ્યા એમ જાણ્યું. આ વાત તેણે તેના પતિ વીરને કહી. વીરે તેણીને સ્વરૂપનું શુભ ઝળ સૂચંધ્રું. ભાગ્યદોગે વીરમતીને ગર્ભ રહ્યો અને તેને શ્રી દેવગુરુની અહિત કરવાના હોછદ થયા તે વીરે પૂરા કથ્યો. સમય પરિપદ્વ થયે વીરમતીએ પુત્રનો જન્મ આપ્યો. તેનું નામ વિમળશાહ પાડ્યું. વીરે જયોતિષી-ઓને ખોવાવી જન્માકાર કરાવ્યા. જન્મ લગ્ન ઉત્તમ હોવાથી અને તેમાં રાજયોગ હોનાથી પંડિતોએ કહ્યું કે-આ પુત્ર કાં તો મંત્રીમુગડ થશે અથવા રાજ થશે.

વિમળ દિવસે દિવસે બેઠો થયો. પાંચ વરસનો થતાં ભલ્લવાનો પ્રબંધ કરવામાં આવ્યો. વિમળે સારી રીતે વિદ્યા સંપાદન કરી. વીર ધાર્મિક વૃત્તિવાળા હતો. તેમનું હૃદય હંમેશાં દેરાગ્યલીનું રહેતું. પુત્રને ઉચ્ચિત સમજી ગૃહભાર ને વિમળની રક્ષાનું છાર્ય વીરમતીને સોંપી તેમણે દીક્ષા લીધી.

વિમળશાહ બહાદુર, હેંશિયાર અને તેજસ્વી હોવાથી દિવસે દિવસે વધારે દીપરા લાગ્યો, તેથી કેટલાક અહેઅા ભાષ્યકો તેની વિરુદ્ધ અટપટ કરી પ્રપંચ રથવા લાગ્યા. વીરમતીથી આ સહન થયું નહી તેથી તે વિમળશાહને હૃદ પોતાના પિયર ચાદી ગઈ.

મામાને ત્યાં રહી વિમળે વછેરા સાથેની ઘોડી લઈ જંગલમાં ફરવા માંડયું. એક વખત જંગલમાં ઘોડીને ચરવા માટે ધૂઠી મૂકી તે જંગલમાં આરામ લેવા જેઠો છે ત્યાં એક સુંદર નવયૌવના સ્ત્રી આવી અને વિમળની પરીક્ષા કરવા તેને ચળાયમાન કરવા યુક્તિ રચી પણ વિમળશાહ જરા પણ ચળાયમાન થયો નહીં અને તેને કહ્યું કે-મારે પરસ્કીનો નિયમ છે. આ જવાબ સાંલળી તે સ્ત્રી કે જે આરાસાણુની અધિધાત્રી અંખાળ હતા અને વિમળશાહની પરીક્ષા માટે નવયૌવના સ્ત્રીનું સ્વરૂપ ધારણ કરેલું હતું તે પોતે પ્રગટ થયાં અને વિમળશાહ ઉપર સંતુષ્ટ થઈ વરદાન આપી અંતર્ધીન થઈ ગયાં.

પાટણમાં શ્રીદત્ત નામના શ્રીમંતના ઘેર તેમની કન્યા મેટી થઈ. તે કન્યાનું નામ શ્રી હતું. શ્રીદત્ત તેના માટે લાયક અને સારા વરની શોધમાં હતા. તેણે વિમળનું પશાકમ જાણ્યું હતું. તેના ચુણોથી પણ તે આડધારેલ હતો. એટલે પોતાની કન્યા તેને આપવા માટે તેણે વીજમતી સાથે નક્કી કર્યો. વિમળશાહ અને તેની માતાને આવા સગા મળવાથી બહુ આનંદ થયો. પણ પાસે જોઈતા પ્રમાણમાં ધન ન હોવાથી જયારે તે પ્રાત થાય ત્યારે વિમળશાહને પરણાવવો એવો નિર્ણય કર્યો.

વિમળશાહ હવે શાખ વાપરવામાં અને તેની ઉપયોગિતા શીખવાના કામમાં લાગ્યો. એક વખત તે ફરતો ફરતો એક ઉજાજડ થઈ ગયેલા ગામમાં ગયો. એક રથળે પોલાણ કેવું લેધ તેણે પોતાની લાકડી તેની અંદર

નાખી અને તેને આવીપાછી કરતો આજુખાજુથી માટીનાં ઢેકાં ઉખાયા તે દ્વાર કરી જોતાં નીચે કાંઈક નષ્ટર વસ્તુ હોય એમ માલૂમ પડ્યું. વધારે એદતાં અંહરથી સોનામહેરાને બરેલો કળશ નીકળ્યો તે વેર લઈ જઈ પોતાની માતા વીરમતીને આપ્યો. વીરમતી ખુશી થઈ અને વિમળશાહને પરણુવવાનું નષ્ટી કરી પાટણ વેવાઈ શ્રીદત્તને ખબર મોકલી. બંને બાનુ લગ્ન માટે તંયારી થઈ અને વિમળશાહની જાન પાટણ આવી અને શ્રી જેડ વિમળશાહના ધામધુમથી લગ્ન થયા. જાન પાછી ગઈ. કેટલોક વખત માતા જેડ વિમળશાહ મોસાળમાં વખત વીતાંયો. ખાદ ખધાને સાથે લઈ તેણે પાટણ આવી નિવાસ કર્યો.

શ્રી ધર્મધોષસૂરિ

આ સમયે શ્રી ધર્મધોષસૂરિ મહાન આચાર્ય હતા. તેઓ હૃદ્દો દેશ વિચરતા પોતાના સાધુ સમુદ્દર સાથે આખુ પર્વતની તળેરીમાં ચંદ્રાવતી નગરીમાં આવ્યા. ગુજરાતના મસ્તકે આખુ પહાડને જોઈ આનંદ ઉપન્યાસો. પણ આ વળતે તે પહાડ ઉપર જૈનોનું એક પણ જિનાલય ન હોતું એટલે મનમાં જ્ઞાનિ પાર્યા. આ પવિત્ર સ્થળે તીર્થ થાય તે સારું તેવો મનસૂઝો કરી શ્રી અંબાજી માતાજીનું ધ્યાન ધરી સ્મરણ કર્યું, તેથી શ્રી અંગિકા હેવી પ્રચ્છન્ન થયાં. તેઓ પ્રત્યક્ષ થતાં ગુરુએ કંધું કે-આખુ પર્વત ઉપર જૈનોનું તીર્થ થાય એવી મારી અભિલાષા છે.

હેવીએ પ્રસન્નમુખે કહ્યું કે-પાટણમાં વીરમતીનો પુત્ર વિમળ છે તેનાથી આ કામ ખને તેમ છે માટે પાટણ પધારો અને તેને આ સંધારમાં ઉપદેશ કરો. આ પ્રમાણે કહી હેવી આંતર્ધીન થઈ ગયા. આચાર્ય મહારાજ પણ ચંદ્રાવતીથી વિહાર કરી વિચરતા વિચરતા પાટણ આવ્યા. સંઘે સુંદર સામૈયું કહ્યું. વિમળશાહ આચાર્યાંભીને વંદન કરવા આવ્યા. વિમળશાહને જોઈ આચાર્ય મહારાજને આનંદ થયો. તેનું લાભ લક્ષાટ અને સંપ્રમાણ અંગોપાંગ જોઈ આચાર્ય મહારાજને ખાત્રી થઈ કે, આ પુરુષ આગળ જતાં મહાપરાકુમી થશે અને ધારેલું કામ કિંદ થશે. આવું સ્વગત વિચારીને વિમળશાહને ચોણ ઉપદેશ આપી, આખ્યું પહાડ ઉપર જૈનો માટે તીર્થ સ્થપનાનું કામ કરવા સૂચના કરી. વિમળશાહે. વિનંતિ કરી કે-તીર્થના કામ માટે પુષ્કળ ધન જોઈએ અને તે હાલમાં તો મારી પાસે નથી. ગુરુએ કહ્યું કે-ધનની ચિંતા કષણે નહિ. આરાસાણ જઈ અંબિકા હેવીની આરાધના કરો તેથી તમારા સર્વે મનોરથો પૂછું થશે. ગુરુનું વચ્ચન પ્રમાણ ગણ્ણી વિમળશાહે સંધ સમુદ્દરાય સાથે, શ્રી આરાસણ જઈ, અજ્ઞાનનો ત્યાગ કરી, ગુરુએ બતાવેલ વિધિ અનુસાર અકૃમનો તપ કર્યો અને હેવીનું ધ્યાન ધરી આરાધના કરી. ત્રણ ઉપવાસનો તપ પૂરો થતાં હેવીશ્રી અંબિકાલુ, હેવીશ્રી ચક્રહેષ્ઠરી અને હેવીશ્રી પદ્માવતી પ્રત્યક્ષ થયાં અને અંબિકાલુએ સિંહનાદ આપ્યો, પદ્માવતીએ અથાગ બળ આપ્યું અને ચક્રહેષ્ઠરી માતાએ

પુષ્ટણ લક્ષમી આપી કામના પૂછું કરી. વિમળશાહ સંઘ
અહિત પાછા પાટણું આંદ્યા અને આચ્યાર્થ મહારાજશ્રી
ખર્મદેવસુરિ પાટણુથી વિહાર કરી અન્યત્ર ચાલ્યા ગયા.

વિમળનો ઉદ્દ્ય

પાટણમાં વિમળશાહે વેપાર વધારવા માંડ્યો. અને
દિવસે દિવસે વધુ વધુ પ્રખ્યાતિ પાડ્યો. આ
વખતે પાટણની રાજગાહી ઉપર સોદંડી વંશનો પહેલો
ભીમહેવ રાજ કરતો હતો. તેણે વિમળ શાહની પ્રખ્યાતિ,
ઝુદ્ધિબળ અને શૂરવીરતાનાં વખાણું ખીલ લોડાના સુખથી
સાંભળ્યાં હતાં. તેણે વિમળ શાહને બોલાવી સન્માન કર્યું
અને તેની શૂરવીરતા અને ઝુદ્ધિ જોઈ, તેને પાટણના
દંનાયકના પદ્થી વિભૂષિત કર્યો. આ રીતે રાજકારણમાં
ગ્રવેશ કર્યોભાઈ વિમળે પોતાની ચાણુકયઝુદ્ધિને ખીલવી.
ધીમેધીમે તેણે મહામંત્રી દામોદર તેમજ રાજવી ભીમહેવ-
નો. વિશેષ ચાહ મેળવી લીધો. કેટલીક લડાઈઓભાં સાથે
રહી વિજય પણ અપાંયો. ધરણી ૧૦૨૪ માં મહસુદ
ગીજનીએ જ્યારે સોમનાથ પાટણું ઉપર ચડાઈ કરી ત્યારે
વિમળશાહ ભીમહેવની સાથે હતો. આ લડાઈમાં ભીમ-
હેવ મહમદના અતુલિત બળ અને પ્રથમને લાધે ઝાંયો.
નહોતો પણ આખરે મહમદ ગીજનીને ડેરાનપરેશાન કર્યો.

વિમળશાહની આ પ્રમાણે ચડતી જોઈ, ધર્ષાખોર
આણસોએ રાજના કાન ભંસેરવા માંડ્યા. આ બાજુ
વિમળશાહે દંનાયકના પદ સાથે, પોતાનો વેપાર

બહુ વધારો, મોટાં સારાં ભક્તાનો બંધાંયાં, ઘેર હાથી વોડા રાખ્યા, પવિત્ર ધર દેરાસર કરાંયું અને ત્યાં હંમેશા શ્રી જિનેશ્વર અગવાનની પૂજા કરવા લાગ્યા. તેને એક નિયમ હતો કે શ્રી જિનેશ્વર અગવાન સિવાય બીજાને નમન કરવું નહીં, તેથી પોતાના હાથમાં શ્રી જિનેશ્વર અગવાનની છથીવાળી વીંઠી રાખતા અને રાજદરખારમાં જાય ત્યારે વીંઠી જન્મસુખ રાખી રાજ તરફ જોઈ નમન કરતો. આ વાત અટપટી માણસોએ રાજને કહી, તેમજ પાછલું લેણું કાઢી રાજને તે વસુલ કરવા જરૂરાંયું. દ્રેષ્ટીઓના કહેવાથી રાજ જાંલેરાયો. અને વિમળશાહ પ્રત્યે શાંકાની નજરથી જેવા માંડયું. વિમળશાહને આ બધી અખર પડી, હવે આ રાજમાં રહેવું તેમને ઠીક લાગ્યું નહીં તેથી પોતાનું ધન, હાથી, વોડા, ધરદેરાસર વિગેરે લઈ શકાય તેટલું લઈ તેણે પાટણથી પ્રયાણ કર્યું. જતાં પહેલાં રાજ પાસે જઈ કહું કે-મારા હૃદમનોએ અટપટ કરી, તમને જાંલેરી, મને હેરાન કરવાના પ્રયત્નો કર્યાં અને તે તમે સાચું માન્યું તેથી મારું લાગ્ય અજમાવવા હું પાટણ છોડું છું પણ હવે ડોઝના માટે આવી રીતે જાંલેરાશો નહીં એમ કહી ચાલી નીકળ્યો.

‘ચંદ્રાવતીમાં આ વખતે પરમાર રાજ રાજ કરતો હતો. વિમળશાહ માલવણ સુખી આવેલ છે અને હવે ચંદ્રાવતી આવવાના છે તેવા સમાચાર પરમાર રાજએ જાણ્યા. વિમળશાહ સાથે હાથી, વોડાસ્વાર, પાયદળ વિગેરે પૂરતો લડાયક

૧. આ ચંદ્રાવતી નગરીનાં ખંડેર હાલમાં આખૂરી તોટીમાં છે.

સામાન હતો. તેથી વિમળશાહ ચંદ્રાવતી આવવાનો છે એમ જાણી પરમાર રાજ પોતાના કુટુંબ સાથે નાસી ગયો, અને આળજથુથી નીકળી વિમળશાહે ચંદ્રાવતી વગર હરકતે કખને હરી અને લીમહેવની આખુ ફેરવી. પોતે રાજ કરવા લાગ્યો. આંતુભાળુના સરદાર સામંતો આનીને મળી ગયા અને પોતાના બળવાન લશ્કરથી ખીંચ કેટલાકને જુતી લક્ષ ખંડિયા બનાવ્યા. ઠંડુના રાજને જુતી લીધ્યો. તેને કેદી બનાવી ચંદ્રાવતી લાવ્યા, તેનો ભારે દંડ લક્ષ છોડી મૂક્યો. ચંદ્રાવતીની પુનરૂર્ચયના કરી કોઈકિદ્વા તથા બનાર બનાવ્યા. દેરાસરો બંધાવ્યા. ધીમે ધીમે ચંદ્રાવતી ચંદ્રકલાની નેમ ભીલતી ગઈ. વેપાર વણું વધવા લાગ્યા. ચંદ્રાવતીની ચડતી કલા જેઠ આંતુભાળુના ઘણ્ણા લોકો ચંદ્રાવતીમાં આવી વસ્યા. ચંદ્રાવતી એક સુંદર સમૃદ્ધ નગરીની ગળગ્રીમાં આવી. વિમળશાહ ત્યાં હવે સુધે રાજઅમત ચલ દે છે અને માગણુ-ભાઈ-ચારણોને દાચિંદુત દાન આપી સંતોષે તેથાં તેની કીર્તિં સર્વ રથણે અવાવા લાગી.

શ્રી સિદ્ધગિરિ અને ગિરનારજુ તીર્થના સંઘ કાઢ્યા અને સંઘપતિની માળ વિમળશાહે પહેરી. ચંદ્રાવતી આંત્યા અને સુગ્રાંતિપૂર્વક યથાયોગ ધર્મદ્યાન-પૂજા-સેવા કરી રાજઅમત ચલાવવા લાગ્યા.

આચાર્ય મહારાજશ્રી ધર્મદ્યાષસૂરીશ્વરજુ વિચરતા વિચરતા ચંદ્રાવતી પદ્માંયો. તેમણે વિમળશાહની કીર્તિ સંભળી હતી. તેથી આખુ ઉપર તીર્થ બંધાવવાની વાત ચાહ કરવા ચંદ્રાવતી આંત્યા. સંઘે અને વિમળશાહે ઘણ્ણા જ

ઉત્સાહથી સામૈયું કથ્યું અને ચાતુર્માસ રહેવા વિનંતિ કરી. ગુરુએ તે માન્ય રાખી. વિમળશાહ હમેશાં આચાર્ય મહારાજ પાસે જય, વંદન કરી એસે અને ઉપદેશ સાંભળે. ગુરુએ પાટણુમાં ફલેલા વચ્ચન ચાહ કરાવ્યાં. ગુરુએ તેને આખ્યુ ઉપર તીર્થ બંધાવવા આદેશ આપ્યો. તેથી તેણે કંડોડો ઝૂપીઆ ખર્ચ કરી આખ્યુ ઉપર શ્રી ઇંધલદેવ ભગવાનનું મોટું અને કોરણીવાળું લંઘ દેરાસર બંધાવી તેમાં વિક્રમ સંબત ૧૦૮૮ માં શ્રી ઇંધલદેવ ભગવાનની પ્રતિષ્ઠા કરી. આ દેરાસર માટે આરાસણુમાં મોણેસરના પહાડ પાસે જરી વાવ નામે વાવ છે ત્યાં આરસની^૨. ખાણુ છે અને મોટા પ્રમાણુમાં આરસ નીકળે છે ત્યાંથી આરસ કઠાવીને વાપરવામાં આવ્યો છે.

૧. આખ્યુ સંઅધીના હકીકત ધણા પુરતકોના છે. હાલમા "કારાજ સાહેનું શ્રી જ્યંતનિઃયજીએ આખૂતી હકીકતનું પુરતક થોડા વખત ઉપર પ્રાસદ કરેલ છે. તેમાં આખ્યુ તીર્થની હકીકત વિસ્તારથી જણાવેલી છે. દેરાસર બંધાવતા વિમળશાહને ખાલણેણે રંજાડેવા પણ ખાલણેને શાન્ત પાડી સંતોષી ડેવી રીતે કામ લીધું તે તેમજ વાલી નામના યક્ષનો સામનો કરી પોતાના ખાહુઅળથી તેને મહત કર્યો તે વિગેરે હકીકત તેમાં છે તેમજ આખ્યુ પર્વત ઉપર દેલગામ અને અચળગઢના નેન દેરાસરોની વિસ્તારથી હકીકત છે. ખીલં રખાનની પણ માહિતી મળે તેવી હકીકત છે. નેતે આ હકીકત જાણવાની ધ્રુવા હોય તેમણે તે પુરતક વાચવું.

૨. આરસની આખ્યુ હાલ પણ જરી વાવ પાસે છે અને તેમાંથી આરસ નીકળે છે. તે આરસ સહેદ ને અણકતો છે. આ આરસના આભલા, પાટડા અંગે મોટી મોટી ચિલાઓ ઉપરેઅમા આવે છે.

ધનમાર્ગ

વિમળશાહે ચંદ્રાવતી આંદ્રા બાઢ લડાઈમાં ધણું ધન પ્રાપ્ત કર્યું અને તે પ્રમાણે ખરચ પણ ધણો કર્યો. તેણે ભાટ, ચારથું, માગણું ને પણ દાન-શિરપાવ આપી રાજુ કર્યો. આ પ્રમાણે ધનનો વ્યય થતો તહુપરાંત વિમળશાહની પત્ની પણ તેમના પતિની ગેરહાજરીમાં દાનનો પ્રવાહ ચાલુ રાખતી. વિમળશાહ એક પ્રસંગે અણું ગમેતા. તે સમયે પાંચ સો ભાટ વિમળશાહની કીર્તિ સાંલજી આંદ્રા. તેમને વિમળશાહની પત્ની શ્રીઓ પાછા ન જવા હેતાં પુષ્કળ દાન આપી સંતોષ્યા. આવી રીતે દાનાદિકમાં દ્રોય વપ્યશતાં દેરાસરો બાંધવા અને તેમાં કરોડો ખરચવા માટે ધન મેળવવાની જરૂર હતી. વિમળશાહને દેવીતું વરહાન હતું અને આરાસાણુના પહોડોમાં પુષ્કળ અનીજ હતું. વિમળશાહની દિલ્લિ એ તરફ ગઈ. તે કામનો આરંભ કર્યો. અનીજવાળા પત્થરો કઢાંદ્રા અને આરાસાણુના દેરાસરોનો પૂર્વની ટેકરીઓ ઉપર કારીગરો અને મજૂરો રાખી, પત્થરો અને મારી ગળાવી તેમાંથી સોનું કઢાંદ્રાં અને તેથી આખ્રી અને અં. રાસાણુનાં દેરાસરો બાંધાંદ્રાં. આ સોનું અને અનીજ દ્રોય કાઢવા માટે જે લડોઓ કરવામાં આવેલી તેનો ભડોઓમાંથી નોકલેલો લાખો મણું કચરો હાલ પણ ત્યાં જમીનમાં હઠાયેલો પડ્યો. એ અને તેનો ફેટલોક ભાગ બહાર પણ પડ્યો છે. વળી ધમણુમાં બેસાડવાના મારીનાં ભુંઝળા તે વખતનાં બનાવેલાં તે પણ કાટડામાં ધણી જયાએ ભાંગીતૂટી હાલતમાં નજરે પડે છે. આ કબરાને ધણા લોકો

કાટડો છણે છે. આ કાટડાનો ટુકડો હાથમાં લઈ નિરીક્ષણ કરતાં સામાન્ય બુદ્ધિનો માણુસ જાણી શકે કે અહોમાં નાખેલા પદાર્થમાંથી સારભાગ (ખનીજ) નીકળી જઈ આ કચરો છિરો-વણો રહેલો છે. હાલ પણ આ ટેકરીએ અને તેની આસપાસના ભાગમાં ખનીજવાળા પરથરો ધૂટાછવાયા ઘડેજા છે તેમજ સોનાના રજકણુવાળા ટુકડા પણ મળે છે. દેરાસરો અને ટેકરીએ ફરતો આરાસણુમાં જે કોટ બાંધીતૂરી હાલતમાં હાલ પણ જણ્ણાય છે તે કોટ આ કાટડાથી બનાવેલો છે.

આરાસાણુ તીર્થ

આરાસાણુમાં જ આરસની ખાણુ હતી અને દેરીના વરદાનના પ્રતાપે પુષ્કળ સોનું મહું તેથી આરાસાણુમાં જિનાલયો બાંધનાતું અનુકૂળ થયું. આખૂ ઉપર સં. ૧૦૮૮માં પ્રતિષ્ઠા થઈ તે પછી આરાસાણુમાં કામ શરૂ થયેલું જણ્ણાય છે, કારણુ કે આ દેરાસરોમાં સં. ૧૧૧૪, ૧૧૨૮, ૧૧૭૬ના કેટલાક દેખ છે તેથી આખૂ ઉપર જે કારીગરોના હાથથી કારણીનું કામ થયું હાય તે જ કારીગરોએ અહીં પણ કામ કરેલું જણ્ણાય છે, કારણુ કે આખૂના દેરાસરની કારીગીરી અને આરાસાણુના દેરાસરોની કારીગીરી ધણીખરી મળતી આવે છે.

આરાસાણુના દેરાસરો અને દેરીઓમાં જે પ્રતિષ્ઠાએ દેરામર તૈયાર થતાં થયેલી તે પ્રતિમાળ હાલમાં દેરાસરો અને દેરીઓમાં નથી. કારણુ કે જ્યારે સં. ૧૩૫૫માં આદશાહતું આ પ્રદેશ ઉપર આક્રમણ થયું તેની અગાઉ આરાસાણુના જૈનોએ ઝીકના લીધે તમામ પ્રતિમાળને ઉત્થાપન કરીને કોઈ ડેકાણે ભંડારી

શીખા છે, તે હજુ સુધી કયાં છે તે જાણવામાં આઓયું નથી; પણ જ્યારે આ પ્રતિમાળું પ્રગટ થશે ત્યારે આ તીર્થના ધર્તિહાસ ઉપર નવું અજવાળું પડશે. હાલ તો કાઉસગીએલાળું અને દેરાસરેની અંદરની દેરીએના પભાસનો ઉપરના જે જૂના ચિત્રાલેખ છે તેથી સંતોષ માનવાનો છે.

દેરાસરો

આ આરાસાણું તીર્થમાં પાંચ દેરાસરો છે. તેમાં ચોંકું દેરાસર શ્રી નેમિનાથ પ્રભુનું છે. આ દેરાસરની અને શ્રી પાશ્ચાનાથ પ્રભુના દેરાસરની બાંધણીનો ધાર એકસરખો છે. શ્રી અહાવીરસ્વામીના દેરાસરનો અને શ્રી શાંતિનાથ પ્રભુના દેરાસરનો ધાર એકસરખો છે. પાંચમું દેરાસર ને નેમનાથ પ્રભુના દેરાસરથી દક્ષિણ તરફ ખસો વાર હૂર આવેલું છે તેની બાંધણી ઉપરના ચાર દેરાસરો કરતાં જીવી અને સાદી છે. આ હેરું નાનું છે અને મૂળ આરાસાણું ગામતું હોય તેમ જણાય છે, જે કે તેમાં પાછળથી ચુધારાવધારા થયા છે. આ પાંચે દેરાસરો શિખરખદ્ધ છે અને પાયામાંથી શિખર સુધી તમામ આરસ વપરાયેલો છે, ને આરસ પહુંચુ આરાસાણુની આરસની ખાણનો છે. છેત્વા દેરાસર સિવાયના ચારે દેરાસરોમાં ચોવીભુ ચોવીભુ દેરીએ છે. બધા દેરાસરો દૂરતો કોટ છે અને તે બધા દેરાસરો ઉત્તરાદી બારના છે.

૧. આ દેરાસરોમાં ઘડા લંખા છે. અમદારાદ શેડ આષંદું જીવાખુણી પેઢી તરફથી લાલમાં આખા હિન્દુસ્તાનનાં નેતૃ મંહિરો મંગેરાના ડીરેટાનું કામ ચારે છે. અહીંના મંહિરોના તમામ લેખો તે પુસ્તકમાં પ્રચિદ થશે.

૧. આ તીર્થમાં મુખ્ય અને મોટું જિનાત્ય શ્રી નેમિનાથ લગવાનતું છે. તે વિશાળ અને ઊંચું છે. દેરાસરને ફરતી નીચે હાથીની હાર છે તેથી તે ગજસર કહેવાય છે. તે ઉપર નરનારીનાં જોડકાં છે તેથી નરસર કહેવાય છે. તે ઉપરાંત હેવ, હેવી, યક્ષ-યક્ષિણીનાં મોટાં પૂતળાં ફરતાં એસાડેલા છે અને તેની વચ્ચમાં કેટલાક કામશાખના જોડકાં છે. દેરાસરના પાછલા ભાગમાં ગોખની અંદર સમળી વિહારનો અડધો પટ ચોડેલો છે તેમાં લંકાના રાજ, તેમના ઘોળામાં રાજકુંવરી, લેટણું ધરતાં જૈન ગૃહસ્થ પગવાં, ઘોડો વિગેરે આરસમાં ડારેલાં છે અને નીચે લેખ છે. આ સમળી વિહારનો બાકીનો અડધો ભાગ જેમાં સસુદ્ધ, નમંદા નહીં, આડી, સમળી, પારધી, જૈન સાધુમહારાજ, વહાણુ કોતરેલાં છે, તે પટ હેરીઓ પાસે જ્યાં હેરીઓનાં પણાસન કાઢી નાખેલાં પડ્યાં છે ત્યાં દીવાલ પાસે મૂકેલો છે. તેને સારા સ્થાન ઉપર ચોડાવવાની જરૂર છે.

આ દેરાસરમાં ગલારો, સભામંડપ, ચોકી, ચોકી ઉપર નીચે અંબાળ માતાની હેરી, ગોખલા, વિશાળ દંગમંડપ, ચોવિસ હેરીઓ, દંગમંડપમાંથી બહારની કમાનના પગથિયાં અને પગથિયાં ઉપર ટકોરખાનાનો ઝરુઘો છે. ગલારામાં મૂળનાયક શ્રી નેમિનાથ ભગવાનની મોટી અને ચમત્કારિક પ્રતિમાળુ બિશાજમાન છે. આ પ્રતિમાળુ પરમપૂજ્ય શ્રી હૃરવિજયસૂરિના પદૃપદ આચાર્ય શ્રી વિજયહેવસૂરિના સમયમાં સં. ૧૧૭૫ માં શ્રી કુશળસાગર ગણ્યિના હાથે પ્રતિષ્ઠિત બચેલાં છે, તે ખંબંધીનો લેખ ભગવાનના પણાસન ઉપર રૂપે વાંચી

શકાય તેવો છે. ગભારામાંથી બહાર નીકળતાં ખારણું પાસે એ મોટા કાઉસગીયાળ છે અને તેમની પાસે બંને બાજુના ઓટલા ઉપર ચાત પ્રતિમાળ પરોણું દાખત બિરાજે છે. તેની આગળ સભામંડપની દીવાતમાં એ મોટા કાઉસગીયાળ છે. તેમના નીચે સં. ૧૧૧૪ના લેખ છે. આ એ કાઉસગીયાળની પડખે એક નાના પ્રતિમાળ બીત્તમાં એસાડેલ છે. સભામંડપના મુખ્ય દ્વાર પાસે સભામંડપમાં આથમણી બાજુની દીવાતમાં ૧૭૦ પ્રતિમાળનું શુષ્પ એસાડેલું છે. તેના ઉપર લેખ છે, પણ તે વાંચવામાં આવી શકે તેવો નથી. આ સિનાય સભામંડપમાં નાના કાઉસગીયાળ અને ઈન્દ્રની પાખાણુની છૂરી પ્રતિમાએ છે અને ધાતુની પંચતોથી તથા સિદ્ધયક અને હેવીનો મૂર્તિએ તે પણ છૂટાં છે. સભામંડપમાં ધુમટમાં ત્રણ સો વરસ પહેલાં રંગનું કામ કરેલું છે તે નાણે હમણું જ થબેલું હોય તેવું હેખાય છે. સભામંડપમાંથી બહાર નીકળતાં ચોકી છે તેના ઓટલા ઉપર કેશર ધરાય છે. તેની જ પાસે અંબાળ માતાજીની ફેરી છે. આ ફેરીમાં *અંબાળ માતા

* કેન ધર્મમાં આ નેમિતાથ પ્રશ્નુના શાસનહેરી અંબાળ છે. કેન માન્યતા પ્રમાણે માતાજી અંબાળની મૂર્તિ થાતિ સ્વરષ્પની છે. તેમના હાથના ડરીની તુંંચ, અંકુથ હોય છે અને આળક હોય છે. તેવી આ મૂર્તિ છે. તેમના ડાઢા ભાગ ઉપરની મનુષ્યાકૃતિ એ હાથ જોડી ઊભા છે. તે રિમણથાં હોય એમ કહે છે. આવી મૂર્તિએ શ્રી મહા-નીરસ્વામીના દેરાખરના મભારામા તેમજ શ્રી પાશ્ચનાથ ભગવાનના દેરાખરના મભારામાં છે. તે ઉપરોત મહુડીયાપાઠર તથા દાંતાથી

આસનહેવીની મોટી મૂર્તિ છે. ખીલુ બાળુ ગોખલા છે તેમાં એક મોટા ગોખલામાં પ્રતિમાળનો શુપ, નંદીશર દીપનો દેખાવ છે અને ઓટલાના છેડા ઉપર એક કાઉસગીયાજ, તેમની ઉપર પ્રતિમાળ ને કાઉસગીયાળની બાળુમાં નાના પ્રતિમાળ છે. ચોકીથી નીચે ઉત્તરતાં રંગ-મંડપ છે. ચોકીની ઉપર અને રંગમંડપમાં કોતરણી કામ સુંદર છે. રંગમંડપમાં કોતરણી ઉપર રંગ કરેલો છે. રંગમંડપની આસપાસ ચોવીસ હેરીઓ છે તે (માં ૨૨) ખાલી છે અને જુણોદ્વાર વખતે તેમાંથી પખાસન તથા પરધર કાઢી નાખેલાં. તેના ઠગલા બન્ને બાળુ ઓટલા ઉપર પડેલા છે. ચોવીસ હેરીમાં પૂર્વ પશ્ચિમ વચ્ચેલી એ હેરીઓમાં જે મોટી છે તેમાં પૂર્વ તરફ શ્રી રૂપભદ્રે લગવાનની મોટી મૂર્તિ બિરાજમાન છે. તેના ઉપર સં. ૧૯૭૫ નો લેખ છે. સામેની આથમણી હેરીમાં શ્રી. પાંદીનાથ લગવાનતું મોટું બિંખ છે. તેના ઉપર લેખ નથી. આ બિંખ એટલું મોટું છે કે નીચે

આવેલી ને મૂર્તિઓ શ્રી મહાવીરસ્વામીના દેરાસરમાં બેસાડેલ એ, તેમાં આરત્તસની એ તથા ધાતુની એ મૂર્તિઓ તથા સરસ્વતીની એક મૂર્તિ એક હેરીમાં છે. તે પણ તેવાજ વાટની છે. ધાતુની મૂર્તિ પાંચ શ્રી અભયહેવસૂરિ અને હેમયંદ મહારાજના નામ ખીજ બેઘો સાથે કોતરેલી છે.

નૈનેતરો ને અંબિકામાતાળને પૂને છે તેમના હાથમાં અદ્ભુત નિશ્ચળ વિજેર આધુદ હોય છે અને એક હાથમાં રાક્ષસનું અધુદ હોય છે.

જિભા રહી, લવાટમાં ચાંદદો કરી શકાતો નથી એટલે બાળુમાં લાકડાંની ઘાડી મૂકેલી છે. આ તરફના જંગલી લોકો શ્રી પાર્થનાથ ભગવાનને ભીમાદાદા, શ્રી આદીખર ભગવાનને અર્જુન અને શ્રી નેમનાથ ભગવાનને યુધ્ધાધિર કહે છે. આ હેરાસરમાં ૬૪ થાંબલા છે. તેમાં વચ્ચેના ૨૨ થાંબલા કારીગરી અને કોતરણીયાળા છે. તેના ઉપર દેવ, દેવીઓ અને વિદ્યાધરીની મૂર્તિઓ છે. બીજી થાંબલા સાઢા છે. હેરાસરના છોડની પાછળનો તથા આજુભાજુનો ભાગ ખાલી છે. રંગમંડપમાં ઉપર પૂજા મહેતસુર વખતે ઐરાઓને બેસરાના ઝરખાં છે. આ હેરાસરમાં ભર્તી ચોડદો એક લેખ છે તેમજ થાંબલા ઉપર લંખ છે. હેરાસરની બાંધણી એવી સરથ છે કે બહાર જિભા રહીને શ્રી નેમિનાથ પ્રલુના દર્શન કરી શકાય છે.

૨. બીજુ હેરં શ્રી મહાવીરસ્વામીનું મોટા હેરાસરની પૂર્ણ બાળુની ટેકરીએથી નીચા ભાગમાં-એઠરાહા બારનું છે. આ બારણું ચિવાય તેને પૂર્ણ-પદ્ધિમ બારણું છે. પદ્ધિમ તરફનું બારણું હાડ બંધ રહે છે. પૂર્ણ બાળુનું બારણું પદી આગળના ચોકમાં પડે છે. હેરાસરના છોડ ઉપર આમરણનું કોતરકામ છે. સમામંડપ અને સમવસરણની હેરી ઉપરના ધુમટો સામરણ ગોઠવેલા છે. ગલારામાં શ્રી મહાવીરસ્વામી ભગવાનની ભંય અને સુંદર મૂર્તિ છે. તેમના પમાસન ઉપર સં. ૧૧૭૫ નો લેખ છે અને તે પ્રતિષ્ઠા શ્રી કુશળસાગરગણિએ કરેલી છે. ભગવાનના પમાસનની નીચે હેવી છે. તેમના પમાસન ઉપર સ. ૧૧૨૮ ની

સાલનો લેખ છે. ભગવાનની ઉપર અને આનુભાજુ આર-
સતું સુંદર પરધર છે. ગભારામાં એક તરફ શ્રી અંબિકા
માતાજી અને ષીલ તરફ યક્ષની મૂર્તિ છે. ગલારાની બહાર
સલામંડપ છે. તેમાં મોટા એ કાઉસગીયાળ છે. તેમની
ઉપરના લેખ વંચાતા નથી. તે સિવાય ગભારામાં વણું નાના
કાઉસગીયાળ છૂટા છે. સલામંડપમાંથી નીકળતાં ચોકી આવે
છે તેમાં એ ગોખલા છે અને ઉપર નાના છ ધુમટ છે. તેમાં
સલામંડપમાંથી નીકળવાના બારણું પાસેનો ધુમટ અલૌ-
કિક કારીઅરીવાળો છે. તેની અંદર પડા આરસમાં એવા
સરસ ડોતરેલા છે કે અત્યારે તે કામ કાગળ ઉપર પણું
બની શકે નહીં તેમજ આ ધુમટનો જેટો ષીજો કયાંય હોય
તેમ જણ્ણાતું નથી. તે સિવાયના પાંચ ધુમટનું કામ પણું
બહુ જ ઉત્તમ પ્રકારનું છે. લટકતાં કમળ વોલક અને
પડાવાળા છે. ચોકીથી નીચે ઉત્તરતાં રંગમંડપ છે. તેના
ધુમટની કોરણી અલૌકિક અને ચહિત કરે તેવી છે. તેની
અંદર જણે દરિયાની છીપો જરી હોય તેવો દેખાય છે.
ધુમટની વચ્ચમાં કમળ આકારનું મોટું આરસતું જુમર લટ-
કતું છે. જુમરમાં નીચેની પાંખડીનો થાડો ભાગ તૂટી ગયો છે
ને અત્યારે કોઈ કારીઅરથી હુરસ્ત થાય તેમ નથી. ચોકી
અને રંગમંડપ તથા દેરીઓની વરચે એ બાનુ આરસની
છત છે. તેમાં જૈન ધર્મનો ઈતિહાસ ડોતરેલા છે. પૂર્વ તર-
ફની છતમાં સાત ભાગ પાડેલા છે તેમાં એકમાં આચાર્ય
મહારાજ વ્યાખ્યાન વાંચે અને ચતુર્વિધ સંઘ આવે છે; જેસે
એ અને વ્યાખ્યાન સંબંધે છે તેવો દેખાવ છે. ષીજામાં

આચાર્ય મહારાજ સાધુઓને વાચના આપે છે તે દેખાવ છે. ત્રીજમાં દેવીઓ કોરેલા છે, તેની જેણા બાગમાં દેવતાઈ નાચના દેખાવ છે અને છેદ્વા સાતમા ભાગમાં શ્રી મહાવીરસ્વામી ભગવાન દેશના હે છે અને ગણુધરો એડા છે અને સંઘના માણુસો જુદા જુદા જુદા વાહન ઉપર સ્વાત્રી હરી આવતા હોય તેવો દેખાવ છે.

પશ્ચિમ તરફની છતના ભાગમાં ખાત ભાગ છે તેમાં પહેલા પાટમાં ગર્દ (અતીત) તેમજ આવતી (અનાગત) ચોવીકીના તીર્થિકર ભાળસ્વરૂપે માતાના જોગામાં છે. બીજા ભાગમાં વચ્ચે વર્તમાન ચોવીશી શ્રી રૂષલહેવ ભગવાનથી શ્રીમહાવીરસ્વામી ભગવાન સુધીના છે । અને ઝરતું શ્રી પાંચનાથ ભગવાનનું લુચનચરિત્ર છે. તેમાં ચામા માતાનું શયનગૃહ, ચૌદ સુપન, પ્રસૂતિગૃહ, પ્રભુને ઈંદ્ર મહારાજ મેરુપર્વત ઉપર અભિષેક મારે લઇ જાયં છે તે દેખાવ અને બીજાં કલ્યાણક, કમઠનો ઉપસર્ગ તેમજ પાછલા ભરનો દેખાવ છે. આ બધું આરસમાં કોતરેલું છે. ત્રીજ ભાગમાં અઠથામાં શ્રી શાંતિનાથનું અને અઠથામાં શ્રી નેમિનાથનું ચરિત્ર, પંચ કલ્યાણક અને ચરિત્રના બીજા દેખાવો ચાયે કોતરેલું છે. ચોથા, અને પાંચમા ભાગમાં દેવીઓ છે. છુટા ભાગમાં શ્રી મહાવીરસ્વામી ભગવાનનું ચરિત્ર કોતરેલું છે. તેમાં પાછલા સત્તાવીક ભર, જનમ વિગેરે પાંચ કલ્યાણક, તપસ્યા, કાનમાં ખીલા ઠોક્યાના તથા વૈદે તે કાઠયાના પ્રથંગો, ચંડકોશિયાનો તથા ચંદનખાળા ચાયેના પ્રથંગો

આખેહું કેતરેલા છે. આતમા ભાગમાં શ્રી ઇષ્ટભદેવ ભગવાનનું ચિહ્ન પંચકલ્યાણુક સાથેનું છે.

આ કેતરકામ નીચે તે શું કેતરેલું છે તે અમજુ શકાય તે માટે દરેકની નીચે આરસમાં અક્ષરો ઓછી હકીકિત જણાવેલી છે ને તેમાં શાહી પૂરેલી છે. તેથો જરા મહેનત લઈ વાંચવામાં આવે તો તુરત સમજુ શકાય છે. આવી રીતે હનીર વરસ પહેલાંની એતિહાસિક કેરણીનું કામ ફીજે સ્થળે ભાગ્યે જ જોવામાં આવે છે.

ચોકી અને ૨ રંગમંડપ કુરતી ચોવીસ દેરીઓ છે તે બધી ખાલી હતી. તેમાં એ ત્રણુ સિવાય બીજુ દેરીઓમાં પણ સન અને પરંધર છે. તેના ઉપર ૧૨ મા, ૧૩ મા સેંકાના લેખ છે. આ બધી દેરીઓ તથા ચોકી ઉપરના ગોખલામાં સં. ૨૦૦૧ ના જેઠ સુદી ૧૦ ના હિંસે પ્રતિમાજુ પરોણા દાખલ બિરાજમાન કરેલાં છે. આ પ્રતિમાજુ કુંભારીયાળથી આસરે વીશ ગાડ ઉપર હક્ષિણુમાં દાંતા રાજ્યની હથમાં મહુડીયાં-પાદર નામનું ગામ છે તેની પાસેના જંગલમાં લગભગ અઠથા માઈચ જેટકી જગ્યામાં પડી ગયેલા દેરાસરોનાં અંડિયેરો છે, તે અંડિયેરમાંથી સં. ૧૯૬૬ માં કોઈ માણ્યસમે જરૂર ડોવાથી પત્થર ઉખાડતો હતો તેને લોંઘરું માલૂમ પડયું. આ હકીકિત દાંતા રાજ્યના જાણવામાં આવતા ચોચ્યા બંદોખસ્ત કરી ચોકી બેસાડવામાં આવી અને સં. ૨૦૦૦ ના માટ ભાસમાં રાજના અધિકારીઓને મોકલી જંગલ સાંક કરાવી લોંઘરું ચોલાંયું. અંદરથી પ્રતિમાજુ નીકલ્યા. તે દાંતે લાવવામાં આંગા. આ પ્રતિમાજુ જૈન

ક્રવેતાભર આભનાયના ડોવાથી દાંતાના સંધને રાજ્યે સુપ્રત કંબા અને કુંભારીયાજુના જિનાલયમાં તેને સ્થાપવા માટે સૂચના ફરી. દાંતાના સંધે અમહાવાદ શેડ આણુંદજુ કલ્યાણુંને તારથી અભર આપી અને કુંભારીયા પેઢી ઉપર સમાચાર મોહલ્યા તેથી કુંભારીયા પેઢીના મુનીમ દાંતે જઈ સં. ૨૦૧૦ના માછ વહિ ૧૩ ના રોજ તે પ્રતિ-માને ગાડામાં સારી રીતે પખરાવી કુંભારીયાજુ લાવ્યા તેમ જ દાંતાના દેશસરમાં કેટલાક વધારાનાં પ્રતિમાલ હતાં તે પણ કુંભારીયાજુ લાવવામાં આવ્યાં. સં. ૨૦૦૧ માં કારી-ગરો બેસાડી તમામ પ્રતિમાલને ઓટીપણું કરાવી ચક્કુ ટીકા વિગેરેથી વિભૂષિત કરવામાં આવ્યા અને ૨૦૦૧ ના જેઠ સુદી ૧૦ મે અઠાર અભિવેક મહોત્સવ કરી આ શ્રી મહાવીરસ્વામીના દેરાસરમાં દેરીઓમાં પરોણા દાખલ બિરાજમાન કરવામાં આવ્યા તેથી આ દેરાસરની બધી દેરીએ પ્રતિમા બિરાજમાન થવાથી ભરાઈ ગઈ. પૂજન ચાનું થયું. દેરાસરની શોભામાં વધારો થયો.

આ દેરાસરના પૂર્વ તરફના બારણું પાસે જમણું હાથ ઉપર સમવસરણુંની ફેરી છે. તેમાં પ્રતિમાલ નથી. સમવસરણુંની રચના પીળા આરણ ઉચ્ચર સુંદર કારીગરી-વાળી છે. સમવસરણુંના ઉપરના ભાગમાં બહુ જ જીણી કારીગરી છે.

આ દેરાસરની કોરણી લણી જ ઉત્તમ છે. લણોદાર વખતે આ દેરાનું ધણુંખરું કામ સર્કારીખંડ થવાથી બધું બરાબર રૂપણ જેઠ શકાય છે. દેરાસરનો પાછળનો

ભાગ કોટ સુધી ખાલી છે. આથમણી બાજુ, દેરીએ પાસે, પાછળના ભાગમાં ઓરડી છે તેમાં એ અંડ છે. તેમાં લોંયરું હોય તેમ જણાય છે. દેરાસરના પૂર્વ તરફના ભારણામાંથી બહાર નીકળતા જમણી બાજુ આરસનું જીણી કારીગરીવાળું પરઘર કમાન સાથે છે. અને તે આ દેરામાં શ્રી મહાવીરસ્વામી ભગવાન આગળ ઓટલા ઉપર હતું અને જીણોઢાર વખતે કારીગરોએ બહાર કાઢેલું ર્યાં જ પડી રહ્યું હોય એમ જણાય છે. આ પરઘરને ચોગ્ય જગ્યાએ મૂકુવાની જરૂર છે, કારણ કે હબદારો ઝીપીએ ખરચતાં પણ આવું કામ બની શકે તેવું નથી.

૩. શ્રી મહાવીરસ્વામીના દેરાસરની પૂર્વ બાજુ શ્રી પાશ્ચનાથ ભગવાનનું દેરાસર છે તે મોટું અને લંબ્ય છે. આ દેરાસરનું આથમણી બાજુનું ભારણું પેઢી આગળના ચોકમાં પડે છે અને અવરજવર તે જ ભારણે વિશેષ હોવાથી હાતમાં સુખ્ય ભારણું ચોતરાહું છે તે બંધ રહે છે. આ દેરાસરમાં ગલાડો, સલામંડપ, ચોકી, રંગમંડપ, દેરીએ અને ટકોરખાનાનો અરૂપો છે. તે અરૂપા નીચે પગથિયાં ઉત્તરી સુખ્ય દ્વારથી બહાર નીકળવાનો રહ્યો છે. ગલારામાં શ્રી પાશ્ચનાથ પ્રલુનાં પ્રતિમાળ બિરાજમાન છે. તેના પણાસન ઉપર સં. ૧૬૭૫ નો લેખ છે અને કુશળસઃગર ગણ્યું પ્રતિષ્ઠા કરાવેલી છે. સલામંડપમાં એ મોટા કાઉસગીયાળ છે. તેમના પણાસન ઉપર સં. ૧૧૭૬ નો લેખ છે. તે ચિવાય ત્રણ નાના કાઉસગીયાળ છૂટા છે અને એક મૂર્તિં શ્રી અંબિકાહેવીની છૂટી છે. સલામંડપથી બહાર નીકળતાં ચોકી

૩. તેના ઉપર છ ધુમટ નાના છે. તેની અને સભામંડપના બારણુની કાદીગરી બહુ જ જીવા પ્રકારની છે. ચોકીના ઓટલેથી ઉત્તરતાં રંગમંડપ છે. તેમાં પણ ઉમદા કારી-ગરી છે. દેરીઓ ચોવીસ છે તે ખાલી છે. તેમાં ધણી દેરીઓમાં પરધર પણાસન સાથે મોંજુદ છે. પણાસનમાં લેખ છે તે ૧૨ મા અને ૧૩ મા સૈકાના છે. દરેક દેરીનો આગળના ધુમટ પણ કારીગરીવાળા છે. દેરીઓમાં પૂર્વ પશ્ચિમ બાળુની વચ્ચી દેરીઓના બારણાં અને પરધર કલામય ડેાતરણીવાળા છે. થાંભતા ઉપર પણ દેવીઓ અને વિદ્યાધરીઓ તેમજ ડેાતરણી કરેલી છે તેમજ થાંભતાઓની વચ્ચે કમાનો પણ ડેારણીવાળી છે. દેરાસરનો પાછળનો લાગ કોટ સુધી ખાલી છે. આથમણી બાળુ એ ખંડની ઓરડી છે તેમાં પેઢીનો પરચુરણ સામાન પડી રહે છે. આ ઓરડીના અંદરના ખંડમાં ખંડ કરેલું લોંઘરું છે.

૪. શ્રી મહાવીરસ્વામીના દેરા આગળ રહ્યો રહ્યો શ્રી શાન્તિનાથ ભગવાનનું દેરાસર છે. તેની બાંધણી મહાવીરસ્વામીના દેરાસરને મહતી છે. આ દેરાસરને ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ તરફ બારણુ છે. પશ્ચિમ તરફનું બારણું ખંડ રહે છે. જાત્રાળુની અષરજવર પૂર્વ તરફના બારણે થાબ છે. ઉત્તર તરફનું બારણું ખાસ કામ સ્વિવાય ખંડ રહે છે. અભાશામાં શ્રી શાન્તિનાથ ભગવાનની મૂર્તિ બિરાજમાન છે. તેના પણાસન ઉપર કં. ૧૩૦૨નો લેખ છે. અભાશામાં મૂળનાથક ઉપરાંત નાના કાઉસગીવાળ, દિદ્ર વિગેરેની છૂટી મૂર્તિઓ છે. અભાશ બહાર સભામંડપ છે. સભા-મંડપની આગળ ચોકી છે. તેના ઓટલા ઉપર છ ધુમટ

કારીગરીવાળા છે અને ખારણું પણ કારીગરીથી ભરપૂર છે. ચોકની નીચે રંગમંડપ છે, તેમાં કારીગરી ભરપૂર છે. રંગમંડપ અને દેરીઓની વર્ચે છ તછે. એ ખાજુની છત જે રંગમંડપની બન્ને ખાલું છે, તે છતમાં જેણ ધર્મનો ધર્તિહાસ આરસમાં કોતરેલો છે. પંચકલ્યાણુક આથેનાં તીર્થેંકર ભગવાનનાં જીવનચરિત્રો, કદમ્બસૂત્રમાં આવતા કેટલાક પ્રસંગો, સ્થૂલિકદ્રના પ્રસંગ વિગેરે કોતરકામ છે અને દરેકની નીચે લખેલું છે યથ સાહી પૂરેલી નથી તેથી બરાબર જણાતું નથી. આ દેરાસરનું સફ્ફાઈનું કામ જીણોદ્વાર વખતે બરાબર થખેલું નથી, એટલે તેમજ દેરાસરની આગળ આડી ઢોલાથી પ્રકાશ બરાબર આવતો નથી તેથી અંધારું રહેવાથી પૂરેપૂરું જેક્ષ શકાતું નથી. દેરીઓ ચોનીશ છે તે ખાલી છે. ઘણીખરી દેરીઓમાં પરધર અને પખાસન છે. પખાસન ઉપર ૧૧મા, ૧૨મા અને ૧૩મા સૈકાના દેખ છે. થાંભલાઓની કોરણી તથા ખારણુની કોરણી બીજા દેરાસરોને મળતી છે. પાછળના ખાલી ભાગમાં એક દેરી છે, તેમાં નંદીશ્વરકીપની રચના છે. મૂર્તિઓ નાની નાની પણ બધી ખંડિત છે, તેની બહાર ગોટલા હિપર ગોખલામાં સૂર્ય ચક્ષની મૂર્તિ છે, તેને બીજા દોકો ગણુપતિ કહે છે, તે લીંતમાં જ એસાડેલી છે. તેની બન્ને ખાજુ બીજી મૂર્તિઓ લીંતમાં ચોડેલી છે તેમાં એક ચામરધારી છે. બીજી ખાજુએ એ ખંડની ઓરડી છે. આ દેરાસરમાં, રંગમંડપની આગળ થોડા વખતથી દોખંડની જળી નાખેલી છે, તેથી ધુમટ વિગેરેમાં જાનવરો

માળા નાખી શકતાં નથી પરન્તુ તેથી પ્રકાશમાં ઘટાડો થયો છે. દેરાસરના ચિખરનો ધાટ આમરણુની કોતરણી-વાળો છે, સભામંડપ અને દેરીના ધુમટ સામરણુથી વિભૂષિત છે.

૫. ઉપરના ચાર દેરાસરો ઉપરાંત પાંચમું હેરો મોટા દેરાસરની દક્ષિણે બસો વાર દૂર જાવેલું છે. તેને સંભવનાથનું દેરાસર કહેવામાં આવે છે. આ દેરાસર ઉપરનાં ચાર દેરાસર કરતાં નાનું છે, તેમજ બીજ દેરાસરો કરતાં થોડું દૂર છે. ધાટ પણ જુહો છે, તેથી મૂળ આરાસ્પષ્ટ ગામનું દેરાસર ઢાય એમ જલ્દાય છે. ગભારામાં એક પ્રતિમાળ છે. તેના ઉપર લેખ નથી. લછન જોતાં ચિંહનું જલ્દાય છે. તેથી શ્રી મહાવીરસ્વામીની મૂર્તિ ઢાય એમ માનવામાં આવે છે. સાધુ મુનિ મહારાજ પણ એમજ ધારે છે. ચિંહને ઘોડો માની સંભવનાથની પ્રતિમાળ જલ્દાયાં ઢાય અને તે નામ પ્રચલિત થયું ઢાય એમ જલ્દાય છે. ગભારા બહાર બારણામાંથી નીકળતાં ડાણી બાળુના ગોખલામાં એ મૂર્તિએ સ્વીપુરુષની છે. તે કોઈ ગૃહસ્થની ઢાય એમ જલ્દાય છે. પૂર્વ તરફના બારણા પાસે હીરાતમાં ગોખલામાં એક નાની ખાંડિત પ્રતિમાળ છે. સભામંડપમાં મૂર્તિએ ઐસાઠના નાના ગોખલા પરથર સાથેના છે. સભામંડપની બહાર છૃદ્ગ ઓટલા ઉપર રંગમંડપ ધુમટ સાથે છે. દેરા કુરતો કોટ છે.

ઉપર બત્થા મુજબ દેરાસરો પાંચ છે તે એકખીજથી જૂદાં અને છુટાં છે. નેમિનાથ ભગવાનના મોટા દેરાસરના રંગ-મંડપમાં એક જોંયરું છે. તે મોદું છે. તેનું મોદું ખુલ્લું છે અને અંધી ઉત્તરી શકાય છે. તેમાં એકાંદ એ ખાંડિત પ્રતિમા છે. તે

હાતમાં પંદર કુટના આશરે છે અને પછી પત્થરની હીવાત આવે છે. આ લોંઘરા માટે એવું ઠેણવાય છે કે—આ લોંઘરામાં આખૂ પર્વત ઉપર જઈને નીકળાતું હતું અને આખૂ પર્વત ઉપર અદ્ધર ઢેવી છે ત્યાં બહાર નીકળવાનો રહ્સ્યો હતો. તે વાત માનવામાં આવે તેવું કંઈ નિશાન જણ્યાતું નથી. કુંગરો, નદીઓ, પહોડામાં લગભગ ૨૫ થી ૩૦ માદિલિ સુધી લોંઘરં સ્થળંગ હોય તે ગળે જિતરે તેવી હકીકત નથી.

આ દેરાસરોમાં તેની લભ્યતા અને બારણી કોરણી જેતાં કરોડો ઇચ્છિયાનો ખર્ચ થયેલો જણ્યાય છે. થાંબલા, બારણાં અને ધુમટોની કોરણી આખૂ ઉપરના દેલવાડાના શ્રી આદીક્ષર ભગવાનના હેરાને મળતી છે. કેટલેં ડેકાણે તેનાથી ચડી જય તેવી છે. દેરીઓ ઉપરના લેખો જેતાં દેરાસરો તૈયાર થયા બાદ જુદા જુદા સમયે તેમાં પ્રતિક્ષાઓ થયેલી હોય તેમ જણ્યાય છે. આ દેરાસરો ખંધાયા તે વખતે આરાસાણુ, ચંદ્રાવતી, હડાહ, પોસીના વિગેરે નગરો જૈન વસ્તીથી ભરપૂર હતાં, અને તેથી તેઓ તથા ધીજા લોકો જરૂર જાત્રા કરવા આવતા અને આરાસાણુના જૈનો સંભાળતા. લીમહેવ સોલંકી પછી સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ તથા વસ્તુપાળ તેજપાળના સમયમાં જૈન ધર્મની સોણે કળાએ ચઢતી હતી અને જૈન મંહિરોનું સારી પેઠે રક્ષણું થતું. અને તે સમયે આ મંહિરો પણ સુંદર સુરક્ષણ નીચે હતા.

મુસલમાની કાળમાં નુકસાન

પાટણમાં વાધેલા વંશનો છેલ્દો રાજ કરણ વાધેલો થયો. તેના રાજમાં માધવ અને ફેશવ નામના એ ભાઈઓ

પાટથ્થના પ્રધાન હતા. કેશવની સ્વી બહુ જ રૂપાળી હતી. તેના પ્રત્યે રાજ કરથ્થની ખૂરી દાનત થઈ અને કેદી પણું પ્રકારે તેને મેળવવાના પ્રયાસ કરવા માંઝો પણ બન્ને પ્રધાનો પાટથ્થમાં હોય ત્યાં સુધી કંઈ બની શક્યે નહિ, એમ વિચારી માધવને કામ ખતાવી દેશાવર મોકલ્યો. તેના ગયા પછી કેશવની સ્વીને રાજમહેલમાં આણ્ણી લાવવા પ્રપંચ કરી માણ્ણસો મોકલ્યા. કેશવે ચોતાની આખરું બચાવવા પ્રયાસ કરેંટે પણ સત્તા આગળ શાસ્યપણું નિષ્ઠળ નીવડયું. એવટે કેશવ મૃત્યુને આધીન બન્યો અને તેની પત્ની કમળાદેવીને દરખારમાં લાવવામાં આવી. માધવ બહાર જામથી આવ્યો ત્યારે તેના જલ્દુબામાં આ બધી હક્કીકત આવી અને તેને બહુ જ ગુર્સો ચક્કો પણ એકલાથી રાખાની સામે બાથ લીડાય એમ ન હોતું અને બીજી આજુ વેરની જવાણા ભલુકી રહી હતી. ચોતાના અવિચારી પગલાથી રાખ્યનો, કરથ્થનો અને દેશનો નાશ થશે તેનો કંઈ પણ વિચાર કયો સિવાય તે પાટથ્થથી નીકળી દીહ્વીના બાદશાહને ગુજરાત ઉપર ચંઈ કરવા સમજવવા માટે દીહી ગયો.

આ વખતે દીહીની ગાઢી ઉપર અત્માઉદીન ખૂની બાદશાહ હતો. તે બહુ જ કૂર અને ધર્માંની હતો. માધવે તેને મળી બધી હક્કીકત હણીને ગુજરાત જીતવા સમજાયું. બાદશાહને તો એટલું જ નોઈતું હતું. તેણે ગુજરાત જીતવાની તૈયારી કરી અને સં. ૧૩૫૬* માં

* શ્રી નિનભસુરિએ તીર્થ્યકલ્પમાં લખ્યું છે. “ ગાહ તેરહસ્ત દ્વારા દ્વારા વિક્રમચરિસે ભલાશહીણ સુરતાણસ્ત કણિદ્દો

બાદશાહી મોડું લશ્કર લઈ તેના ભાઈ ઉલુભાનને ગુજરાત જીતવા રવાના કર્યો. આ લશ્કરે રસ્તામાં ગામો ઉજ્જવળ કર્યો, એતીવાડીને નાશ કર્યો, દેવણો તોડી નાખ્યાં અને ગુજરાત તરફ ઝ્રચ કદમ કરતો ચાલી નીકળ્યો.

દીક્ષોથી ગુજરાતમાં આવવાનો માર્ગ મારવાડ, મેવાડની વચ્ચે થઈને હતો. અને લશ્કર આવવાની અને તેનાથી થતા નાશની હુક્કીકિત આગળથી સંભળાતી તેથી આરાસાણુના જૈનોએ પ્રલુની મૂર્તિઓ કે દેરાસરો અને દેરીઓમાં હતી તે તમામ ઉઠાવી લઈ કોઈ સ્થળે લંડારી દીધાં. રૂક્તા કાઉલ્લગોયા ને ન ઉઠાવી કે ઉખેડી શકાય તે દેરાસરોમાં રહેવા દીધા. લડારેલી પ્રલુની પ્રતિમાળ કુયાં છે તે હજુ સુધી જણવામાં આવ્યું નથી.

બાદશાહનો લાઈ લશ્કર લઈ આરાસાણુ આવ્યો. મંહિરમાં મૂર્તિઓ નહેાતી. કાઉસગીઅણુને ખંડિત કર્યો. કારીગરી કે જેને તૈયાર કરતા વરસો લાગેલા, તેને અકેદ

**ભ્રમયા જલુખાન નામધિજાઃ દિલ્લાપુરાઓ મંતિમાહશપેરિયો
ગુજરાષરં પદ્ધિઓ ”-**

તેનો ભાવાર્થ એવો છે કે-વિક્રમ સંવત ૧૩૫૯ ના વરસમાં અલાઉદીન સુલતાનને ભાઈ ઉલુભાન મંત્રી માધવની પ્રેરણાથી દીક્ષોથી ગુજરાત આવ્યો. ગુજરાતની જૂની પાઠમાળામાં એક કવિતા છે તેમાં જેમ જણાવવામાં આવ્યું કે “ સ. ૧૩૫૩ સાલ વિક્રમની જ્યારે અલાઉદીન દીક્ષા તરીકે પર એકો લાં ” આ ઉપરની કવિતાની એ લાટીથી જેમ સમજાય છે કે-અલાઉદીન ૧૩૫૩ માં ગરીએ આવ્યો. અને તે પછી નષ્ટ વરસે ગુજરાત ઉપર ચડાઈ કરી.

ધાચે તેડી નાખ્યી. ને પાંખડીઓ બનાવવામાં કારીગરેાચે ચેતાની કળા વાપરેલી તેનો એક ક્ષણમાં નાશ કર્યો. આરાસણુના નગરજનો લયભીત થિયેતા હતાં તેમને લુંટી લીધા, મારી નાખ્યા અને કેટલાક નાસી ગયા. ગામને લુંટી બાળી નાખ્યું અને આગળ ચાદ્યા જયા. ચંદ્રાવતીનો પણ આ સમયમાં નાશ થયો. આખૂના મંહિરોને તુકશાન કર્યું. ચર્વત્ર હાહાકાર બ્યાપી ગયો અને સુલક ઉજગડ થઈ ગયો, વરતી રહી નહીં. દેરાસરો ખાલી જંગલ વચ્ચે જિલ્લાં રહ્યાં.

હિન્દુસ્તાનને મુસ્લિમાની વખતમાં બહુ જ સહન કરવું પડ્યું છે. હિન્દુસ્તાનના રજુપુત રાજ્યોએ અંદરથિંદરના અધડા-ઓને લઇ અરસપરસ :લડી-અધડી બહુ જ નાશાં પડી ગયા હતા તેથી સામે ધવાની હીરમત રહી નહોતી તેથી કોઈ સામે થઇ શક્યું નહીં. કોઈ એકાઈ શૂરવીર રાજ સામે ધાય તો બાદચાડના બળ આગળ તેનો નાશ થતો અગર તાણે થવું પડતું એમ છતિહાસ કહે છે. મુસ્લિમાનોએ આ સ્થિતિનો લાભ લઈ સંસ્કૃતિ અને કળાનો નાશ કર્યો. લુંટફાટ ફરી ગામો સળગાંધાં. એતીવાડી પાયમાલ કરી લોકોનો નાશ કર્યો અને જે હાથમાં આવ્યા તેમને જબરજસ્તીથી વટલાવી સુસ્લિ-માન કર્યો. આ આદેતમાંથી આરાસણ પણ બચી શક્યું નહીં.

આરાસાણુમાં ચારે તરફ ટેકરીએ, કુંગરો અને પહાડો છે. વસ્તી રહી નહોતી. દેરાસરો ખાલી જોખા હતાં. ત્યાં દિવસે દિવસે આડી જામી ગઈ ને જંગલ થયું. તાપ, વરસાદ અને જંગની જે કુદરતી આગ લાગી તેનો ધૂમાડો વાગવાથી તેમજ જંગલી લોકોએ સુના પડેત્રા દેરાસરમાં

વસવાટ કથો હેઠાં તેથી દેરાસરો અંદર અને બહાર કાળાં
 થતાં ગયાં અને આવી સ્થિતિમાં સં. ૧૩૫૬ થી ૧૬૭૫
 સુધી જિલ્લાં રહ્યાં અને કાળાશના થી ઉપર થર જામતા ગયા.
 આ મંહિરાથી એક માઈલ દૂર અંબાજીનું સ્થાનક છે અને
 ગુજરાત મારવાડના વણું જત્રાળું ત્યાં આવે છે. અલાઉદીન
 ખાદ્યશાહની પછી કેટલાક ખાદ્યશાહના વખતમાં કંઈક
 શાંતિનો સમય આવેલો અને અકબર ખાદ્યશાહના વખતમાં
 સારી રીતે શાંતિ હતી. તે વખતમાં અંબાજીની જત્રાએ
 સારી રીતે યાત્રાળું આવવા માંયા. તે અને માતાજીમાં
 ને જનેતરા રહેતા તેમણે અંબાજીનો મહિમા વધારવા આ
 દેરાસરો સંબંધી ઓટી વાતો વહેતી મૂકી. જે કે અંબાજી માતા
 શ્રી નેમનાથ પ્રભુની શાસનહેવી છે, આચાર્ય મહારાજ
 શ્રી ધર્મધોષસૂરિને તે દેવી પ્રત્યક્ષ હતાં, અને સૂરિમહારાજના
 ઉપદેશથી વિમળશાહે આરાસણું આવી તપ કરેલું અને
 દેવી પ્રસન્ન થયેલાં એટલે નીચેની વાત લોકોની ઉપજની
 કાઢેલી છે એમ ચોક્કસ મનાય છે. માતાજીનો મહિમા
 જગતમાં જાહીરો છે, પણ જનેતર અજ્ઞાની અને વહેમી માણસેએ
 એવી વાત અલાવી કે-વિમળશાહને માતાજી પ્રસન્ન
 થયાં અને એક રાતમાં ૩૬૦ દેરાં બધાંયાં, પછી વિમળશાહને
 કોના પ્રતાપે દેરાં બધાંયાં એમ માતાજીએ પૂછ્યું ત્યારે
 વિમળશાહે જવાબ દીધો કે-ગુરુના પ્રતાપે. આવી રીતે દેવીએ
 ત્રણ વાર પૂછ્યું. તેનો તેવો જ ઉત્તર મળવાથી માતાજીએ
 દેરાં બાળી નાખ્યાં અને નમૂનાનાં સાડાત્રણ દેરાં રાખ્યાં.
 વિમળશાહ લોંઘરામાં થઈ નાસીને આખું ઉપર જતા

સ્વા. આવી વાત પ્રચલિત કરી અને તે વાત માતાજીના ગરબામાં વહી લીધી તેથી હાલ આ દેરાં જેવા આવનાર હજુ પણ સંભારે છે પણ વિમળશાહ ૧૧મા, ૧૨મા સેકામાં થયાં. ૧૦૮૮માં તેમણે આબૂ ઉપર પ્રતિષ્ઠા કરી અને આરાસાણુના દેરા બંધાંયા પછી થોડા વખતમાં એટલે બારમા જેકાની અધવચ એટલે સં. ૧૧૫૦માં તેની હ્યાતિ નહેાતી, આરાસાણુના દેરાસરોમાં ૧૨મા, ૧૩મા ને ૧૪મા સેકામાં દેરીઓમાં પ્રતિષ્ઠાઓ થએલી છે અને અલાઉદીન સં. ૧૩૫૬માં આંયો ત્યાં સુધી દેરાસરોની જહેજલાલી હતી. વિમળશાહ તે વખતે નહેાતા તો પછી ઉપરના દેરાસરો બાળી નાખ્યાની વાત બીલકુલ ખોટી અને ઉપજલી કાઢેલી છે એમ ચોક્કસ મનાય છે. હાલ તો બગામે આવનાર ઘણું જૈનેતરઃ ગુહસ્થોને જ્યારે હડીકિત સમજલી સમજણું ખાડવામાં આવે છે એટલે તે તુરત જ માતાજીએ દેરા બાળી નાખ્યાની વાત ખોટી છે એમ સમજે છે. વળી અત્યારનાં પાંચ દેરાસરો માટે જે જગ્યા રોકાએલી છે તેના પ્રમાણુમાં જે ૩૬૦ દેરાની વાત કહેવામાં આવે છે તેના માટે કટલી જગ્યા રોકાય તે પણ સમજુ માણુસો વિચારી શકે છે.

કટલાક માણુસો સોનું કાડી લીધા પછી જે કચરો રહેબો છે તેને દેરાં બળી ગયાના નિયાન તરીકે બતાવે છે પણ તે વાતને સમજુ માણુસો જપ માને છે. જૈનેતરો અંબાજ પ્રત્યે સારો અભિજ્ઞાન હશોવે છે, આસ્થા રાખે

છે અને પૂણું ઉદારતાથી તેમનું સંન્માન કરે છે. વળી યાત્રાએ પણ વારંવાર આવે છે; જ્યારે જૈનોએ આ બાધત ઉદાસીનતા સેવી. આતું પરિષ્ઠ્યામ એ આંધું ફે-કૈનેતરોએ સારા વિદ્ધાન માણ્યસોને પણ ઊંઘે રસ્તે હોડેતા છે. ડેટાટર બંડારકર,* ક્ષારખસ સાહેબ. અને મહીકાંડા ડીરેક્ટરીના બનાવનાર પણ આ મંહિરની બાધતમાં અવળે રસ્તે હોરાયા છે. તેમણે મન ક્ષાવે તેમ લખી નાખ્યું છે. તે વખતના દેરાંની સ્થિતિ અને કૈનેતરોએ ને વાત સમજાવી તે પ્રમાણે નોંધ કરી લખ્યું છે પણ જો ઊંડા ઉત્તરી તપાસ કરી હોત તો તેમને પણ ખરી વાત માલૂમ પડત.

* ડેટાટર બંડારકર કહે છે કે ને અવશેષો છે તેથી અહોં એક જમાનામાં ૩૬૦ મંહિરો હોવા જોઈએ. આ હીકૃત ટેક્નોલોજી ઉપરનો કાટડો જોવાથી જૈનેતરોએ તેવું સમજાવ્યાથી લખી હો પણ જો તેમણે તે અવશેષો તપાસ્યા હોત તેમજ ૩૬૦ દેરાસરા માટે ડેટલી જમીન જોઈએ તે ઇથીએ તપાસ કરી હોત તો આવું લખત નહીં. ક્ષાર્ખસ સાહેબ ધરતીકંપને લીધે મંહિરો જમીનહોસ્ત ચ્યાતું લખે છે તે પણ જૈનેતરોના સમજાવ્યા પ્રમાણે લખેલું છે. ધરતીકંપ થાથ તો પાંચ દેરાસર બીલકુલ સલામત હેવી રીતે રહે ? તેથી એ વાત માનવા નેવી નથો. મહીકાંડા ડીરેક્ટરીના કર્તૌ ઉપરની નોંધોના આખારે લખે છે તે પણ મલત છે. ક્ષાર્ખસ સાહેબ અને બીજા હેવા અવળે રસ્તે દેરનાઈ ગયા છે તેનો એક જ દાખલો ને રાખ્યાં છે તે અસ્ત છે. રાખ્યમાળામાં ક્ષાર્ખસ સાહેબ લખે છે કે “માતાજીના દેરામાં ને મૂર્તિ” પુલય છે તે પ્રથમ શિવની અર્ધાંગના અને હિમાચળ તથા મેનાની પુત્રી દુર્ગા છે” આવું લખી માતાજીના દેરામા મૂર્તિ છે એમ બતાયું છે પણ અંભાળ માતાજીના દેરામા મૂર્તિ નથી. જોખ છે અને તે બંન્ધી વિભૂષિત છે. જોખમાં આગીનો શાખુગાર કરવામાં આવે છે એટલે મૂર્તિનું ૩૫ જણાય છે.

તીર્થોદ્ધાર

નેમ માણુસને ચડતી પડતી આવે છે તેમ સ્થાનોને પણ
ચડતી પડતી અનુભવવી પડે છે તે પ્રમાણે આ હેરાસરોના સંખ-
ખમાં પણ થયું છે. હિલ્લી ઉપર અવાઉફીન પછી વંશ
બદ્ધાયા અને બાદચાહેલા પણ બદ્ધાયા. તે પ્રમાણે સોતમા
સૈકામાં દીદખીની ગાડી ઉપર અકબર બાદચાહ થયો. તેના વખ-
તમાં હિન્દુસ્થાને કંઈક છુટકારાનો દમ એંચ્યો; કારણું કે
આ બાદચાહ હિન્દુ સુખલમાનને સરખા ગણુંતો. તેના રાજ્યમાં
જુદ્ધમ કર્મી થયો હતો. બાદશાહની સભામાં પંડિતો લેગા થતાં,
ધર્મની બચોઓ થતી અને તે સર્વ ધર્મને સરખા ગણુંતો.
આ વખતે જૈનાના મહાન આચાર્ય શ્રીમહ્મ હીરવિજયસૂરિ વિદ્ય-
માન હતા. તેમની પ્રચંસા અને ખ્યાતિ હિન્દુસ્થાનમાં સ્થળે
સ્થળે હતી તે સાંભળી અકબર બાદચાહને તેમની સુલાક્ષણ લઈ
ધર્મબચો સાંભળવાની ધૂંબણ થઈ.

આચાર્ય મહારાજશ્રી શ્રીહીરવિજયસૂરિ આ સમયે
ગુજરાતમાં વિચરતા હતા અને ભર્ય પાસે કાવીગંધારમાં
હતા. અકબર બાદચાહે ગુજરાતના સૂખા ઉપર આચાર્ય
મહારાજને મોકલવા કરમાન મોકલ્યું અને પૂરતા બંદો-
બરસ્તથી મોકલવા જણ્ણાંયું. સૂખાએ માણુસો મારકૃત
અને અમદાવાહના સધની મારકૃત આ હકીકત આચાર્ય
મહારાજને પહોંચાડી. જિનથાસનને લાભ સમજ
આચાર્ય મહારાજ બાદચાહને મળવા તૈયાર થયા અને
વિહાર કર્યો. અમદાવાહના સૂખાએ તેઓ સુખપૂર્ણ રીતે

પહેંચી શકે તે માટે સુખાસન, શીગરામ વિગેરે આધન-
સામથ્રી આપવા તૈયારી બતાવી પણ તે જૈન સાધુને
અપે નહીં એમ કહી શુરૂએ વિહાર ચાલુ કર્યો. કેટલીક સુદૃતે
વાંચો પંથ કાપી આથ્રા શહેરમાં બાદશાહને મહ્યા અને
જૈન ધર્મનું *રહસ્ય. સમલાંયું. આચાર્ય મહારાજની પાટે
શ્રી વિજયસેનસૂરિ થયા અને તેમની પાટે શ્રી વિજયહેવ-
સૂરિ થયા.

આરાસાણુ ઉઝ્જ્વલારીયાળથી પૂર્વમાં પોસીના ગામ
છે, ને હાતમાં મોટા પોસીનાના નામથી ઓળખાય છે.
હાતમાં ત્યાં પાંચ દેરાસરો છે અને જૈનોની વસ્તી ૧૫
થી ૨૦ ધરની છે. આ ગામ પહેલાં મોટું હતું અને
જૈનોની વસ્તી મોટા પ્રમાણુમાં હતી. આ ગામ અત્યારે
કાઢેારના તાબામાં છે અને ધડક રાજની હદમાં આવેલ છે.

આચાર્ય મહારાજ વિજયહેવસૂરિ વિહાર કરતા કરતા
પોસીનામાં આવ્યા. જૂના પુસ્તકેાના આધારે આરાસાણુ
તીર્થની શોધ કરવા પ્રયાસ આરંસ્યો અને તપાસ કરી
હેરાસરો શોધાવ્યા. પોસીનાથી જૈનો સાથે, આરાસાણુ
આવ્યા. હેરાસરો ઉલેલાં જોઈને અને તેમની કરુણ સ્થિતિ
જોઈ આશ્ર્ય અને ઐદ અતુલંયો. જંગલમાં પ્રતિમાળ
વગરનાં કાળા મૈથ જેવા રંગે રંગાઓલાં હેરા જોયાં અને

* અકાર બાદશાહ અને દીરવિજયસૂરિ તેમજ મુનિરાજભી વિદ્વા-
વિજયજીએ બખેલ “ સુરીશ્રી ને સાટ ” નામના પુરતકર્મ વિરતાર-
થી મુખાડાતની અને કેન તીથેના પટા મહ્યાની હકીકા છે.

આ તીર્થનું મુનઃ સ્થાપન કરવાનો નિશ્ચય કર્યો. આજુ-
બાજુના જૈન સંઘને યોગાવી લેગા કર્યો. યોગ્ય પ્રભાંધ
કરી, પંડિત કુશળસાગરને ભલામણું કરી. કામ ચાલુ
થયું. દેરાસરો અંદર અને બહારથી સાઝે કરવામાં ધણેણા જ
ખર્ચ થાય તેવું હતું તે બની શકે તેમ નહીં જણુવાથી ફેરા
દેરાસરોની અંદરના ગભારા અને સભામંડદ સાઝે કરાવી,
રંગ કરાવી સં. ૧૬૭૫ માં નવા પ્રતિમાળની પ્રતિક્ષા કરાવી.
સં. ૧૬૭૫ માં પ્રતિક્ષા થઈ તેના વૈખ મોટા દેરામાં શ્રી
મહાવીરસત્તામીના દેરાસરમાં અને પાશ્યનાથના દેરાસરમાં
ભગવાનની પવાંડી નીચે છે. આ રીતે તીર્થ ચાલુ કરવામાં
આયું. આ વખતે આરાસાણુ ઉજ્જવલ હતું. ચંદ્રાવતીનો
નાશ થયેલો હતો તેમજ પોસીના સિવાય બીજું નાનુકમાં
મોટું મામ નહિં હોવાથી આ આરાસાણુ તીર્થની જણવણી
પોસીના જૈન સંઘને સૌંપવામાં આવી. અત્યારના જેવી તે
વખતે મુસાફરીની સગવડ નહીં હોવાથી જગ્નાગુ ધણ્ણા જ
થોડાં આવતાં. અંબાલમાં જે જગ્નાગુ આવે, તેમાં જે
જૈન હોય અને જણુતા હોય અગ્ર દેરાસરોની અભર જણુવામાં
આવે તે દર્શાન કરવા જરૂર આવતા. પોસીના ગામ
બાર ગાડ દૂર હતું અને જંગલમાં રસ્તો વિકટ હોવાથી
વખતોવખત પૂરતી હેખરેખ રાખવાનું બની શકે તેમ
હોય નહિં-અગ્ર અમે તે કારણસર ધણ્ણા વરસના પોસીના-
વાળાના વહીવટ બાદ અહીંનો વહીવટ શેઠ પ્રેમચંદ રાયચંદ,
મુંબદીરાળાના હાથમાં નથો હોય તેમ જણુય છે, અને પછી
અમહાવાદના નમરથેઠે પણ અહીંનો વહીવટ કરેલો છે,

પણ રસ્તાની વિકટતાને અંગે પૂરતા પ્રમાણુમાં જાત્રાળુનો અભાવ અને દેરાસરની શોચનીય સ્થિતિ હોવાથી આવક પણ પૂરતી થતી નહીં અને તેમ હોવાથી જગવડનો અભાવ હોય તે હેખીતું છે. છેદ્વા વખતમાં દાંતા ભામના સંધનો વહીવટ હતો અને એકાદ પૂજારી અહીં રહેતો.

જાત્રાળુને ઉત્તરવા માટે ધર્મશાળા પહેલાં અહીં હતી કે નહીં તેનો કંઈ આધાર મળતો નથી પણ કેટલાક જૂના માણુસોના કહેવાથી જણ્ણાય છે કે અમહાવાદના શેઠ મનસુખલાઈ લગુભાઈએ સં. ૧૬૫૭માં જૂની પડી ગંગેલી ધર્મશાળા હતી ત્યાં કરી ધર્મશાળા બાંધી. આ ધર્મશાળા અત્યારે મોજુદ છે. ધર્મશાળાની પદ્ધતિ દિશાએ થાડે દૂર એક જૂનો કુંડ છે, તેને પણ ધર્મશાળા બાંધતી વખતે દૂરસ્ત કરાવેલો છે.

ધર્મશાળાની પૂર્વમાં-ધર્મશાળાની નજીબ ઉત્તરદક્ષિણ ડાટની દીવાલ છે, અને તે ધર્મશાળાની પાછળના ભાગમાં થાડે દૂર જઈ જૂણો પાડી, પૂર્વ દિશા તરફ વાળી છે અને શાન્તિનાથના દેરાસરની આગળ લાવવાનો વિચાર હો. પણ દીવાલ અધૂરી રહેલી છે. આ દીવાલ જૂનો ડાટ ને મોટા દેરાની પદ્ધતિ દક્ષિણ તરફ દેખીએ ઉપર જાય છે તેની ખરાખર સામે છે. આ દીવાલ ડાણે કયારે બાંધી તે જાણુવામાં આંદ્રું નથી.

સં. ૧૬૬૦ના આસો મહિનામાં આ પુસ્તિકાના લેખક અંબાળ આવેલ અને કુંભારીયાળનાં દર્શાન કરવા અંબાળથી

કુંભારીયા ગયેલા. દર્શાન કર્યાં બાદ હેરાસરોનાં સ્થિતિ જોઈ અદ્દસેાસ થબેલો. હેરાસરો અંદર અને બહાર કાળાં હતાં. કારિગરી પણ કાળી થઇ જવાથી કંઈ સમજતું નહોટું. પૂનરી એક હતો તે દર્શાન કરોવતો. ખર્મશાળા નવી હતી. હેરાસરો તશે આવવાના રસ્તા ઉપર ઉત્તર બાજુ એક દરવાળો હતો અને બીજો દરવાળો પશ્ચિમ બાજુ મહાદેવનું હેરાસર મૂકીને હતો. આ દરવાળ હાત નથી. તેના પત્થરો પણ કોઈ લઈ ગયું વાગે છે.

સં. ૧૯૫૭ માં ખર્મશાળા થઈ ત્યારપણી જાત્રાળું આવતા અને અહીં રહેતા. કોઈક વખતે સંઘ પણ આવતા. ઈડર વહાલીનો સંઘ પચીશ-ત્રીશ વરસ પહેલા અહીં આવેલો હતો. પણ રસ્તાની અગવડતા અને વિકટતા હોવાથી બીજા તીયોના પ્રમાણમાં સંદો અને જાત્રાળું બહુ જ કમી આવતા.

લાણેદ્વાર

હાલના વત્તમાન સૂરિયનેમિસૂરીશ્વરાજ મહાશાજ ભારવાઢમાં વિચરતાં વિચરતાં જાવાત ગામના સંઘ સાથે સં. ૧૯૭૬ ની સાલમાં કુંભારીયાજ પદ્માર્થી અને હેરાસરોની શોચનીય સ્થિતિ જોઈ; કારણ કે સં. ૧૬૭૫ માં અભારા અને સભામંદ્ય સાઝે કરાવેલા તેને પણ તષ્ણસો વરસ થઇ અયેલા અને હેરાસરો છસો વરસથી જંગવમાં ઉલ્લાં રહેવાથી તાપ, વરસાદ અને જંગવના ધૂમાડાથી કાળાં થઇ અયેલાં. કેટલાક વાંબલા હલી અયેલા અને હેરાસરો લાણું અયેલા; કારણ કે સંદે ૧૯૭૫ એહી પણ આ હેરાસરોમાં

કંઈ પણ રીપેરકામ કરાવેલું નહોં. આવા પ્રભાવિક ને લગ્ય જિનાલયોની આવી સ્થિતિ જોઈ સૂરિમહારાજને ધણું ફુઃખ થયું અને જૈન સંધ પાસે જીર્ણોદ્ધાર કરાવવાનો નિશ્ચય કર્યો.

અમહાવાદમાં સમગ્ર હિન્દુસ્તાનના શ્રેતાંબર મૂર્તિ-પૂજાક સંધની પેઢી છે. તે શેડ આણુંદળ કલ્યાણુંલાના નામે ઓળખાય છે. આ પેઢીની શાખાઓ પાલીતાણા, તારંભાળ ને શિખરલુ વિગેરે ધણે સ્થળે છે અને સુંદર રીતે વહીવટ કરે છે. આ પેઢીમાં સમગ્ર હિન્દુસ્તાનના પ્રતિનિધિઓ છે અને અમહાવાદના શ્રીમંત ગૃહસ્થો સ્થાનિક પ્રતિનિધિ તરીકે વહીવટ ચલાવે છે. તે સાથે જીર્ણોદ્ધાર, જીવદ્યા, સીઆતા જૈનોને મહદ વિગેરે વિગેરે ધણા ઉપરોગી આતાઓને સંભાળે છે.

આ. શ્રી વિજયનેમિસૂરિ મહારાજે તે વખતના વહીવટ-કર્તૌ દાંતાના જૈન સંધને અને શેડ આણુંદળ કલ્યાણુંલાની પેઢીના સ્થાનિક વહીવટ કરનાર શેડીઆઓને આરાસાણુ જીર્ણો કુંભારીયાળમાં લેગા કરી સં. ૧૯૭૬માં વહીવટ દાંતા સંધ પાસેથી લઈ શેડ આણુંદળ કલ્યાણુંલાની પેઢીને સોંપાંયો. અને જીર્ણોદ્ધારનું કામ શરૂ કરવા સૂચના કરી.

પેઢીએ વહીવટ હાથમાં લઈ શાખા પેઢીની સ્થાપના કરી. પેઢી માટે સારું મકાન બંધાવવાનું શરૂ કર્યું. પૂરતા માણુસેની સગવડ કરવામાં આવી. સારા હેણિયાર કારી-ગરે. ષોલાવવામાં આવ્યા. આરાસણુની ખાણમાંથી આરસુફાવવા જાંઝા અને થાંબલા, પાટ વિગેરે ને ને કાઢી

નાખવા જેવું લાગ્યું તે કાઢી નાંખી નવા નાખવવા શરૂ કર્યો. અંદર ને બહાર સાંકે કરાવવાનું ચાહું થયું. સેંકડો મજૂરો કામ કરવા લાગ્યા. જંગલ દૂર કરાવવામાં આઠ્યું. આ લુણો-દારનું કામ ત્રણું વરસ ચાલ્યું. ચેઢીએ જેઈતી સગવડ માટે નામદાર શીરોહી દરખાર અને નામદાર દાંતાના રાણ્ણા-સાહેબની મદદ માગી અને તે મદદ તેમણે ઝુશીની સાથે આપી એટલે લુણોદાર માટે જેઈતો સામાન વિગેરે જકાતથી સુકત રદ્ધાં. ત્રણું વરસ લુણોદારનું કામ ચાલ્યું અને હેરાસરો નવા જેવા થધું હીપવા લાગ્યાં-ભગ્નાળું માટે નહાવા ધોવાની, કપડાંલતાની, સેવા-પૂજાની સગવડ કરી, વાસણું ગોદડાંની ગોઠવણું કરી અને તીથાંની જહેજલાલી વધી. સં. ૧૯૬૦ ની સાલમાં જૂના એવાંદરાં ઉતારી વિધિપૂર્વક નવા ચડાવવામાં આવ્યા. લુણો-દારના કામમાં ચેઢીએ લાખેં રૂપીયાનો ખર્ચ કર્યો.

લુણોદાર થવાથી જગ્નાળુંની આવક વધી. સાધુ સાધ્વી પણ પહેલા કરતાં વિશેષ આવવા લાગ્યા. સ્થળની રમણીકતા વધી.

આલુભાળુ સુંદર પહાડ, જંગલ અને તેમાં સુંદર કારીમરીવાળા સુરભ્ય હેરાસરો, કિનેશ્વર ભગવાનની અદ્ભુત તેજસ્વી પ્રતિમાણ અને હવાપાણીની ઉત્તમતાથી જગ્નાળુના અનને ને થાનિ અને સ્વસ્થતા જેઈએ તે અહીં જહેલે ઉત્પજ્ઞ થાય છે. અંબાલુમાતાણુંની જગ્નાને દર્શાવ કરને જગ્નાળુ આવે છે. તે નમામ જૈન અને

જૈનેતરો આ હેરાસરોની કોતશણી અને સુંહરતા જેવા આંધ્યા સિવાય લાગેજ રહેતા હશે.

શેડ આષુંદળ કલ્યાણુણુની અહીંની પેઢીમાં સુનીમ, પૂજારી વિગેરનો પૂરતો બંદોભસ્ત છે. જત્તાળુને કોઈ જતની સેવા-પૂજામાં તેમજ રહેવા માટે હરકત ન પડે તેની પૂરતી કાળજી રખાય છે. પાંચ હેરાસરોમાં નિયમિત દરરોજ સેવા-પૂજા થાય છે અને જાંજે આરતી ઉતરે છે. જત્તાળુસેવા-પૂજાનો, આરતીનો સારી રીતે લાભ લે છે. સં. ૧૯૬૭ ની સાતથી હડાદ અને દાંતાના અષુંદળ જૈન ભાઇઓની મહદની શુલ શરૂઆતથી અતે ધર્મશાળાના મહાનમાં જૈનભાઇઓ માટે લોજનશાળા ઓલવામાં આવી છે. આ લોજનશાળાનો વહીવટ શેડ આષુંદળ કલ્યાણુણુની પેઢી હસ્તક છે. જરૂરજોગા રસોયાને ચાકર રાખી સુનીમની દેખરેખમાં આ લોજનશાળા ચલાવવામાં આવે છે અને તેનો લાભ જત્તાળુને આવે છે તે સારા ગ્રમાષ્ટમાં લે છે. મુનિ મહારાજે તથા સાધી સમુદ્દરને પણ લોજનશાળા થવાથી ખાસ અગવડ પડતી નથી. લોજનશાળામાં જમવાનો કંઈ ચાજો નથી. જત્તાળુને કંઈ મદદ તરીકે આપે છે તેથી લોજનશાળા ચાલે છે. વળી તીથી ભરાવવાનું કામ ચાલુ છે. તીથીના ઝ. ૫૧) રાખેલ અને તેવી ઘણી તીથીઓ ભરાણી છે. જખત મોંઘવારીના લીધે સં. ૨૦૦૨ માં તીથીની રકમ ઝ. ૨૦૧) ઠરાવવામાં આવી છે. અને તેવી રકમેની પણ કેટલીક તીથીઓ ભરાણી છે. લોજનશાળાની સગવડ થવાણી જત્તાળુઓને પણ

આરામ રહે છે. અને ધષ્ટાખરા એ અગર ત્રણ દિવસ જાત્રાનો લાભ લઈ શાન્તિ મેળવે છે. દિવસે દિવસે જાત્રાળુની સંખ્યામાં પણ સારો વધારો થયો છે. સંધ ભાગ્યે જ આવે છે કારણું કે અહીં આવવામાં ખર્ચ વિશેષ થાય છે. પાંચ છ વરસ ઉપર ઉજ્જીવનના સંધની સ્પેશીયત નીકળેલી તેમને આધૂરોડ સ્ટેશનથી કુંભારીયાળ આવવાનો ઈરાહો હતો. પણ મોટરલાડું અને મુંડકામાં જ ભારે રકમ આપવી પડતી હોવાથી અહીં ન આવતાં થીજે ચાલ્યો ગયો. સં. ૧૯૦૧ના કારતાડ માઝમાં પાલનપુર રાજ્યના મોરીયા ગામનો સંધ મુનિ મહારાજ શ્રી હેવિમળાળના ઉપરેશથી આવેલો તેમાં ૭૦ માણસ હતાં અને ત્રણ દિવસ રહેલા હતા. તે સિવાય છેલ્લા વીશ વરસમાં કોઈ સંધ આવેલો નથો.

અહીં ને સાધુ સાધી આવે છે, તે શુજરાતમાંથી દાંતા અને હડાદના માગોં અને આધૂ રોડ(ખરેડી)થી સીધા સડકે આવે છે. વિહાર ધષ્ટા લાંબા છે. આધૂ રોડના રસ્તે રાતે રહેવાની સગવડની ખર્મશાળા છે. દાંતાના રસ્તે દાંતાથી ત્રણેક ગાઉ છેટે ચોકી છે તેમાં રાત રહી શકે છે. હડાદથી આવવાનો રસ્તો સારો નથો. બધા રસ્તા કુંગરો અને આડીથી બરપૂર છે, પણ કંઈ બીક નેહું નથો. અહીં હાલમાં જાત્રાળુની વધતી જરી સંખ્યાને લીધે હાલ ને ખર્મશાળા છે તે પૂરતી નથો. ફેટલોક વખત બહુ જ અગવડ પડે છે તેમજ ફેટ્કું સંધને આવવાનો વિચાર થાય તો પણ ઉત્તરવાની પૂરતી સગવડ નથી. ને ખર્મશાળા છે તે પણ નાની છે અને તેમાં પાછળાનો ભાગ લોજનશાળામાં રોકાનેલો છે. જ્યારે ઉનાળાનો

મોસમમાં ઠંડી કુવાને લીધે જાત્રાળુ સારા પ્રમાણમાં આવે, સાધુ-સાધ્વી આવે તે વખતે બધાંની સગવડ સારી રીતે ફરવી તે પેઢીના વહીવટ ફરનારને સુરક્ષેત્ર સુવાત થઈ પડે છે. તેથી ઓળુ આધુનિક સગવડવાળી ધર્મશાળા તુરતમાં કરાવવાની જરૂર છે. લુણોદ્વાર વખતે ધર્મશાળા કરાવવાની હતી, તેના માટે જોઈતી સામચ્રી પત્થરા દુષ્પ્રોત્સ્વાની તજવીજ થયેલી અને પાયા જોડાવેલા પણ તે કામ બની શક્યું નહીં. અનેઈટ વાડો અને પત્થરો રક્ષેદ્વક્ષે થાય છે. ગાઢલાં જોડાંની પણ વધારે જાત્રાળુ આવતાં અડયણુ પડે છે. પણ તે કરાવવાની તજવીજ ચાલુ છે એમ જાણુવામાં આવેલ છે.

પાણીની સગવડ પણ પૂરતા પ્રમાણમાં નથી. શ્રી શાન્તિનાથ ભગવાનના દેરાસરની આગળ નીચાણુમાં એક ઝુંબો છે. તેનું પાણી સારું છે પણ તે હૂર પડે છે. લુણો-દ્વાર વખતે ઝુંબો કરવનો હતો તે કામ પણ બંધ રહેલું છે. અને ઝુંબો માટે કરેલો આડો પુરાતો જય છે. પાણીના અભાવે બગીચો પણ સારો મેડા બધા દેરાસરામાં પૂરતા પ્રમાણમાં ઝૂલ પહોંચે તેવો થઈ શકતો નથી.

અને મહાવીરસ્વામી અને શ્રી પાંદ્રનાથ ભગવાનના દેરાસરની વચ્ચમાં ચોંક છે તે મૂકી ઉત્તરાદ્ધ બારતું મકાન છે તે લુણોદ્વાર વખતે બંધાવેલું છે અને તેમાં શેઠ આણુંણુ કલ્યાણુણુની પેઢી છે. તેના મેડા ઉપર તણુ ઓરડા અને અગાસી છે અને એક ઓરડી છે. ઓરડામાં જાત્રાળુ તથા સાધુ સાધ્વી ઊતરે છે. ઓરડીમાં શ્રી મણી-

ભાર મહારાજનું સ્થાનક છે. આ તરફના જંગલી લોડો
તેમજ અહીં રહેનાર માણુસોની તેમના પ્રત્યે ભારે આસ્થા
છે. તેમની પણ રોજ પૂજા આરતી થાય છે. ચેઢીમાં
નીચે ઓસરીમાં ઓદ્રિસ છે અને ઓારડામાં વાસણુ તથા પરચુ-
રણ સામાન રાખવામાં આવે છે. પેઢીની બાળુમાં આથમણી
તરફ ખડકીમાં જવાનો ફરવાને છે. તે ખડકીમાં ને મહાનો
છે તે ચેઢીના છે અને તેમાં નોકરોને રહેવાની વ્યવસ્થા છે.
ચેઢીના ચ્યાકમાં પાણી ગરમ કરવાની ઓારડી છે અને તે જ ઓાર-
ડીમાં પુરુષોને નહાવા માટે કામચલાઉ ગોઠવણુ છે. બહેનોને
નહાવા માટે સગવડ નહીં હોવાથી એક છીંડીમાં આગળ
પડ્હો બાંધી દેવામાં આવ્યો છે. ત્યાં બહેનો નહાય છે પણ
પાણીની ઓારડી, પાણી ગરમ કરવા તથા ભાઈઓ અને
બહેનોને નહાવા માટે ચેઢીએ સારી ગોઠવણુ કરવાની જરૂર
છે. ખડકી અંદર અને બહાર બીજુ એ ઓારડીએ છે
તે નોકરોના રહેવાના કામમાં આવે છે. શાન્તિનાથના
દ્વારાસરની નજુકમાં ચેઢી તરફથી બંધાવેલ એક પાકી પર-
બડી છત્રીબંધ છે જેમાં પારેવાને હમેશાં ડાઢા નાખવામાં આવે
છે. એક મહાન ચ્યાક વખત ઉપર દાંતા ફરબાર સાહેબ તરફથી
ધર્મશાળાની દક્ષિણ બાળુ બંધાવેલું છે. તે બંગલાના નામથી
ઓળખાય છે. તેમાં ફરબાર સાહેબ આશ્રિત એક મહા-
રાજ આત્મારામજુ રહે છે અને ફરબાર સાહેબશ્રી
કોઈક વખત ત્યાં આવે છે. દાંતારાન્ધના અધિકારી વર્ગ
વારંવાર તેમની પાસે જય-આવે છે. બંગલાના મહાનની
આસપાસ નાનો બગીચો કરી તેને વાંશની વાડ કરેલી

છે. ખંગલાની ફક્ષિણું તરફે એક મહાદેવનું મહિર છે તે મહાદેવને લોડો કુંલેશ્વર મહાદેવના નામે ઓળખે છે. આ મહાદેવના મંહિરનો ધાર નીચે મોટા દેરાસરને કંઈક અંશે મળતો આવે છે. અધૂરું રહેવાથી અગર પડી જવાથી ઉપરનો બાગ પાછળથી કરેલો જણાય છે, તેનાથી પઞ્ચમે ઓડે ફૂર એક હતુમાનજીની દેરી છે.

દાંતા ભવાનીગઢનું રાજ

આ રાજ જેઠે આ તીર્થનો હાલમાં સંખ્યાં છે તેથી તે રાજનું ટૂંક વર્ણન અહીં અસ્થાને ગણુશે નહીં. મહીકાંઠા ડીરેકટરીમાં તથા ધીજા પુસ્તકોમાં એમ જણાવેલું છે કે-દાંતાના હાલના દરખારના વડવા નગરહઠ્ઠા જે જીધિમાં આવેલું છે ત્યાંથી આરાસાણુના કુંગરોમાં આવેલા અને ચોદમા સૈકાની શરૂઆતમાં ગણખર નામનો પર્વત, જે માતાજી પાસે છે ત્યાં રહી, સં. ૧૩૨૫ માં તે વખતના કેદારસિંહ નામના ઠાડોરે તરસંગ જે હાલમાં દાંતારાજ્યના તાખામાં છે ત્યાં ગાઢી સ્થાપી અને સં. ૧૬૦૦ ની સાવમાં, દાંતા ગામ વસાવી ત્યાં ગાઢી સ્થાપી.

આ દાંતા ગામ હાલ દાંતા ભવાનીગઢ એ નામથી ઓળખાય છે. તે કુંભારીયાળથી દસ ગાઉ ફૂર ફક્ષિણમાં આવેલું છે. તેના ઝરતા કુંગરો છે. દાંતા ભવાનીગઢથી અંબાજી આવવા માટે કુંગરોમાં પાકી સડક છે અને ત્યાં હાલમાં મોટર સરવીસ ચાલે છે. આ ગામમાં હાલમાં શ્રી, જૈતોનાં દસ પંદર ઘર છે. તે સિવાય દિગંબર

નૈનોનાં થોડાં ધર છે. બંને શીરકાના દેરાસરો છે. રવે-
તાંબર નૈનોનું દેરાસર કુંભારીયાળના દેરાસરોના જુલ્દો-
દાર વખતે રીપેર કરી રંગકામથી સુશોભિત અનાવેલું
છે. આ ગામમાં આસરે ૨૦૦૦ માણુસોની વસ્તી હુશે.
રાજગાઢી હોવાથી, મહેલ, બંગલા, બગ્ગીચા વિગેરે હોવાથી
આમની શોભા સારી જણ્ણાય છે. હાથમાં રાજ ઉપર
મહારાણા સાહેબ શ્રી સર ભવાનીસિહલુ સાહેબ કે. સી.
ઓસ. આઈ, રાજ્ય કરે છે. રાજ ભવા અને ધર્મીકિ છે.
માતાળના લક્ષ્મા અને દ્વારું વૃત્તિના છે. હાંતા રાજનો
મુલક ધણ્ણોખરો દુંગરોમાં છે અને વસ્તી મોટા ભાગે
અભણું, અજ્ઞાની અને જંગલી દોકાની છે. રાજના પાંચ
મહાલ પાડેલા છે. તેમાં મહાલકારી અને પોલીસ
થાલું રહે છે. મોટા ભાગોમાં ગુજરાતી આર ધોરણ
સુધીની સ્કૂલો છે. હાંતામાં ગુજરાતી સાથે ઇંગ્રેઝ પ્રાથ-
મિક ટેળવણી મળે તેવી ગુજરાતી સાત ધોરણીની સ્કૂલ છે.

રાજમાં દુંગરોની વર્ણના મેદાનોમાં એતી થાય છે
તેમજ હડાઠ વિગેરે કેટલાઠ જામે મેદાનમાં એતી થાય છે.
હડાઠ અને બામણોઠ વર્ણે મોદું તળાવ છે. તેના પાણીથી
કેટલીક જમીનમાં પીતથી એતી થાય છે. ગામડાઓમાં કાચા-
પાકા ઝૂલ્લાથી પણ એડૂતો એતી કરે છે. મુખ્ય પાક જુવાર,
બંટી, મકાઈ, ધઉં અને અણુનો છે. તેમાં રાજ ભાગ છે,
જંગલમાંથી વાંચ, વળીઓની નીકાશ થાય છે. તેમજ જંગ-
લની બીજી આવક આવે છે. જહાતની આવક આવે છે, પણ
મુખ્ય આવક અંબાળ માતાળની છે.

અંબાજ માતાજ

કુંભારીયાળનાં દેરાસરોથી પશ્ચિમ બાજુ એં માઈલ
છેટે આખૂરોડ જવાના રસ્તા ઉપર માતાજનું મંદિર છે.
તે ધણું જૂનું હોય એમ કહેવાય છે. તેની આસપાસ
યાત્રાળુંઓને ઉત્તરવા ધણી ધર્મશાળાઓ ભાવિકજનો તરફથી
ખંધાવેલી છે. માતાજના મંદિરમાં જવાના સુખ્ય દરવાજે
ચોલીસનું થાણું છે. તે મૂકી ચોક આવે છે. લાંથી પગથિયાં ચડી
જવાય છે. ચોકમાં માતાજનમાં આવતી જતી ચીજ વસ્તુ
માટે દરખારી કોઠાર છે. પગથિયાં ઉપર આરદ્ધ જડેલો ચોક
છે ને સામે આથમણું બારનું માતાજનું મંદિર છે. બારણું
ચાંદીના પત્રે મઢેલા કમાઠવાળું છે. સભામંડપ બહુ જ
નાનો છે. તેમાં ચાંદીના પત્રે મઢેલા વાઘ માતાજની બરોબર
સામે મૂકેલા છે અને છતમાં ધણી જ ધંટીઓ બાંધેલી છે.
તે આરતી વખતે જાત્રાળું વગાડે છે. ગભારામાં માતાજનો
ગોખ છે. તેમાં મૂર્તિં નથી પણ પૂજારી જુદા જુદા દિવ-
સોચે માતાજના વાહનઙ્દપ વાઘ, હાથી, કુકડો જોડવી
તેના ઉપર કયડાં અને ઝૂલથી આંગી બેવી સરસ બનાવે
છે કે મૂર્તિં હોય એમ માલૂમ પડે. બારીકાઈથી જોનારને
અખર પડે કે-મૂર્તિં નથી. પ્રાણણું અને ખાસ જણુઠાર
માણુસ સ્વિવાય ઝીજાને ગભારામાં પૂજા કરવા જવાની મનાઈ
છે. પૂજા કરવા જનારને-માતાજની પાવડીની પૂજા કરવાની
હોય છેભટલું કે જેઓ-સીદ્ધપુરના પ્રાણણું છે, અને વંશપર્વતાથી
પૂજા કરે છે. તે કુટુંબના માણુસો પૂજારી તરીકે કામ કરે
છે. આ ભટજને ઈજારાની રકમ દરખારશીને ભરવી પડે છે.

અને તેના બદલામાં માતાજીની પૂજા કરવાનો અને જગ્નાળુને ભયો કરવાનો હક તેને પણ છે. માતાજીની આગળ નાલું, રોકડ, કપડાં કે ચીજુષસ્તુ જે આવે તે દરખારી કોઈરમાં જાય છે. તેના બન્હોભરત માટે ગભારાની પાઠ ઉપર એક દરખારી માણુસ અને એક પૂજારી એમ એ માણુસ કાયમ બેસે છે.

દરખારી માણુસને આવક સંભાળવાની હોય છે. ભટજીનો માણુસ પૂજારી જગ્નાળુને ચાંદલા ફરી પ્રસાદ આપે છે અને જાયો કરાવવા ભટજી પાસે જવાની સૂચના કરે છે. ભટજી પાસે જગ્નાળુની જગ્નાળી શક્તિ પ્રમાણે ભટજીને આપે છે. ભટજીના મહાન પાસે બદ્ધુકલેરવ-તું સ્થાનક છે. મુખ્ય દરવાજા સિવાય માતાજીના મંહિરમાંથી પૂર્વ તરફ નીકળવાનો દરવાજે છે. તે રસ્તે જતાં આગળ માનસ્કરોપર ચારે તરફ પત્યરથી બાંધેલું છે અને પવિત્ર થવાના હેતુથી જગ્નાળુની તેમાં નહાય છે. આ માનસ્કરોપર .ઘણું ઊંડું છે, અને તેમાં ફેટલીક વખત અક્રમાત્મ થાય છે. પાણી સ્વર્ગ રહેતું નથી, માટે તેમાં પાણી સ્વર્ગ રહે તેની ગોઠવણું કરવાની જરૂર છે. માતાજીના મુખ્ય દરવાજા બહાર મોઢી લોકોની આઠદસ હુકાનો છે. તે સિવાય પ્રાણીઓ, રાજ્યના નોકરો વિનેરે ખર્મશાળાની આભુભાજી રહે છે.

જગ્નાળુની દરખાત હલારીની સંખ્યામાં આવે છે. પુનમ ઉપર ખંડ આવે છે. ચૈત્રી અને ભાદરવી પુનમો ઉપર હજરો માણુસોના મોટા ખંડ આવે છે તે વખતે, અને

આસો અહિનાની નવરાત્રિમાં પુનમ સુધી લરતી ધણી હોનાથી ધણુા માણુસોને ધર્મશાળામાં ઉત્તરવાની જગ્યા મળતી નથી. જત્તાળુઓ માટે ધર્મશાળાઓમાં ઉત્તરવા સિવાય બીજુ કંઈ સગવડ હોતી નથી. મોહીને ત્યાંથી વાસણુ, સીધું લાવવું પડે છે. ગોદડાં આડેથી આપવાનો છનારો છે અને ત્યાંથી ગંધાતાં ગાલાવાળા ગોદડાં મળે છે.

માતાળુ આવનાર જત્તાળુ, કોટેશ્વર, કુંભારીયાળ અને ગણભર જરૂર જય છે. કોટેશ્વર માતાળુથી પૂર્વમાં પાંચ માઈલ ફૂર છે. ત્યાં પર્વતમાંથી પાણીનું જરણુ આવે છે, જે સીધ્યપુર પાસેની સરફલતી નહીનું ભૂળ છે. જરણું પાણી પડવાને માટે નાનો કુંડ છે. તેમાં જત્તાળુ નહાય છે અને બાળુમાં આવેલા શંકરના મંદિરમાં અને વસિષ્ઠ આશ્રમમાં ઝરી પાણી વળે છે. ત્યાંથી કુંભારીયાળનાં જિનાલયોમાં આવે છે. અને ચાર માઈલનો થાક ઢંડકમાં એસી ઉતારી, હેરાસદોનાં દર્શાન કરી કોરણી લેછ ચકિત થાય છે. ત્યાંથી માતાળુ જય છે. ગણભર પહાડ માતાળુની સામે પદ્ધિમ તરફ એ માઈલ ઉપર છે અને ચડાવ સખત છે. માતાળુમાં દરખાર સાહેણે બંધાવેલો બંગલો છે. તેમાં રાણુાળ માતાળ આવે ત્યારે ઉતરે છે. સિવાય એક રસૂલનું મકાન અને લાઈ-બ્રેરી-અમદાવાદના ભુલાભાઈ પંચાલની બંધાવેલી તેમની ધર્મશાળા પાસે છે. માતાળુમાં આખૂરોડ તરફથી આવતા જત્તાળુઓ માટે નાકું છે. ત્યાં મહાલક્ષ્મીની એક્સિસ છે અને અમલહારોને ઉત્તરવાનું મકાન તથા ઘોડાર છે. મકાનની પાછળની ઊચી ટેકરી પર હાલમાં અમદાવાદના

શેઠ કુળોદાસ લસ્કરીએ પોતાને જવા આવવાના સમયે
રહેવા માટે મોઢું મકાન બંધાંયું છે. બીજું એક
મહાન તેની સામે થાડે ફૂર રસ્તા ઉપર છે. તે હરણાની
મેમાન પરોષ્યું આવે તેને ઉત્ત્સવા માટે છે અને એક
બાજુ દાકતર રહે છે. મકાનના એક રૂમમાં દવા-
ખાનું છે. તે સિવાય માતાલુમાં છલેકદીકલાઈટ છે. પાણી
માતાલુમાં ફેરાની સામે મીઠી વાવ છે તેનું તેમજ કુવા-
નોનું વપરાય છે.

માતાલુ અને કુંભારીયા આવનાર ફરેક બગ્ગાળુ પાસે
દાંતાના રાષ્ટ્ર ઝુંડકું (૪૨) લે છે. આ મુંડકાનું ધોરણ
એક નથી તેમજ તેમાં ઉત્તરેતર વધારો થયાં જ કરે
છે. પહેલાં બોછું લેવાતું* તેમાં વધારો થતો થતો
ઝા. ૧-૧૫-૯ લેવાતા. અને ઝીઓ, બાંધણો, બારોટો
પાસેથી ઝા. ૦-૧૪-૬ લેવાતા તેમાં ચં. ૨૦૦૧ ની સાલમાં
વધારો કર્યો છે. માતાલુથી કુંભારીયાલુ જનાર પાસેથી
૦-૦-૬ લેવાતી તેમજ કોટેશ્યા અને અણણર જનાર બગ્ગાળુ
પાસેથી ૦-૧-૦ જુદા લેવાતા તે બંધ કરી હાલમાં ઝા. ૨-૧-૦
અને ઝા. ૧-૨-૦ લે છે. એક દિવસનું બાળક હોય તેનું પણ
ઝુંડકું લેવાય છે. નાકાને વાંસનો આંખો છે અને સામે મોટર
સ્ટેન્ડની બાજુમાં મુંડકાની ટીકિટ બોઝિખ છે. મોટરમાં
અખર પગ રસ્તે આવનાર ફરેક બગ્ગાળુને સૌથી પહેલાં
આ મુંડકાનોઝિસની બારીએ હાજર થવાનું હોય છે

* રાખમાણા ભાગ ૨, નિભાગ ૩, ખાના ૧૮૨ મા મુંડકાનો ઝા.
૧-૦-૦ લેવાતો એમ અતાવેલું છે.

અને ત્યાં પૈસા લરી ચીહ્ની લેવામાં આવે છે. આ ચીહ્નોમાં કેટલા પૈસા લીધા તે લખવામાં આવતું નથી. મથાળે સાતાળુ, કેટેશ્વર, કુંભારીયાળ અને ગણભર ગઢની જગત માટે લખેલું હોય છે. બીજી રસ્તેથી આવવાનાર જગતાળુએ પણ નાડે આવી સુંડકા ચીહ્ની કઢાવવી પડે છે. સુંડકા ભારીઓથી જે ચોહી મળી તે લઈ, જગતાળુ નાકાના જાંપે આવે છે. પહેરાવાળો ચીહ્ની લઈ કારકુનને આપે અને ભાષુસો ગણ્યી જવા હે છે. દાંતાની રૈયત તેમજ જેને દરખારથી તરફથી સુંડકામાં માઝી મલી હોય તેને સુંડકાની ચીહ્ની લેવાની રહેતી નથી.

આવવા-જવાના રસ્તા

કુંભારીયાળ આવવા માટે સુખ્ય રેલ્વે રસ્તેશન આખૂરોડાઠનું છે અને ત્યાં ઉતરી આવવા માટે પાકી સરક છે અને મોટરો હોડ છે. આ સરક સીરોહી અને દાંતા રાજની હફમાં નીકળી છે. આખૂરોડ સ્ટેશનના ચોગાનમાં અંખાળુ તથા કુંભારીયાળ તરફ આવવાની અને આખૂરોડિંગ ઉપર જવાની મોટરો શિલ્પી રહે છે. તે બંને મોટરોની વીકીટો જુદીજુદી ઓફિસેથી મળે છે. અંખાળુ તરફ આવવાની મોટરો એક પારસીની માલીકીની છે અને બંને રાજવાળા પાસેથી તેણે કંદ્રાકટ રાખેલો છે અને સરક તેણે પોતાનો ખર્ચ કરી બંધાવી છે. રીપેશીંગ પણ તે જ કરાવે છે. તે જગતાળુ પાસેથી હું ૧-૧૨-૦ જવાના અને હું ૧-૧૨-૦ આવવાના લે છે. તેમાં આખૂરોડથી જતાં આઠ આના સીરોહી રાજના ટેક્ષના અને માતાળથી

આખૂરોડ આવતાં આઠ આના દાંતા રાજના ટેક્ષના એમ ટીકીટમાં લખેલું હોય છે તેથી મોટરમાં પણ રાજનો કર લાગે છે. આખૂરોડથી માતાળ ક્રક્તા ૧૩ માઈલ છે. એક કલાકમાં આખૂરોડથી માતાળ અવાય-જવાય છે. તેર માઈલના રસ્તા માટે આ બાડું સખત છે. આ રસ્તે આવનાર જત્તાળુ ડેટલાક પગે ચાલીને પણ આવે છે. તેમને રસ્તામાં ચોકી વિગેર કર આપવા પડે છે. કુંભારીયાળ સીધા આવનાર જત્તાળુ માતાળમાં થઈ મજૂર પાસે સામાન ઉપડાવીને કુંભારીયાળ આવે છે. મોટરની સગવડ કુંભારીયાળ તથા ફોટેશર માટે જુહી છે અને તેની ઓફિશ માતાળના ઉગમણું જાંપે છે. આ મોટરવાળા ફોટેશર જનાર આવનાર જત્તાળુ માટે હા. ૦-૧૨-૦ બાડું લે છે. કુંભારીયાળ જવા આવવા માટે ઠંડ નિયમ નથી. તેમજ જૂટાછવાયા જત્તાળુ માટે મોટરની સગવડ ભાગ્યેજ મળી શકે છે. જો ફોટેશર જનારી મોટર તૈયાર હોય અને તેમાં જગ્યા હોય તો કુંભારીયાળ જનાર જત્તાળુને બેખાડવામાં આવે છે અને જ્યાં કુંભારીયાળની સડક જુહી પડે છે ત્યાં ઉતારો મૂકવામાં આવે છે. પાસે સામાન હોય તો ત્યાં મજૂર મળવાની પણ મુશ્કેલી જિભી થાય છે, તેથી જત્તાળુ બનતાં ચુંધી માતાળથી મજૂર પાસે સામાન ઉપડાવી કુંભારીયાળ આવે છે. રૂપેશીયત મોટર કરનાર ડેક કુંભારીયાળ ડેરા પાસે અગ્ર ધર્મથાળા પાસે આવીને ઉતરે છે પણ તેમની પાસેથી ભાડાની રકમ સંલેગ પ્રમાણે હા. ૪-૮-૦ થી હ. ૧૨ ચુંધી લે છે તેથી કુંભારીયાળ આવવાની સગવડ માટે મોટરની

અને તેના ટેક્ષ ચાને બાડાની રકમ નક્કી કરી મોટર સરવીસની ઓફિસે અને કુંભારીયાળમાં તેની સૂચનાને વગતું એઈ મૂકવાની જરૂર છે.

આખૂરોડ સિવાય દાંતાના રસ્તે પણ જન્માળું આવે છે અને ઈડર, વડાલી વિગેરે તરફના જન્માળું હડાદ થધને પણ સીધા કુંભારીયાળ આવે છે. હડાદ થધને આવનાર જન્માળું અહીંથી પચીસ માર્ગલ દૂર અમદાવાદ પ્રાંતીજ રેલ્વેનું ઐડથ્રેના નામનું છેલ્લું રસ્તેશન છે ત્યાં ઉત્તરી, એરોદ સુધી મોટરમાં આવી ત્યાંથી પગરસ્તે આવે છે. આ રસ્તે હડાદથી માતાલું સુધી પાકી સડક ડુંગરોમાં કાઢેલી છે. આ રસ્તે જનવરની બીક હોવાથી ખાસ જાણીતા માણ્સે. સિવાય બીજી આ રસ્તે આવતા નથી. આ સિવાય ડુંગરોમાં બીજી રસ્તા છે પણ તે વિકટ હોવાથી કોઈ જન્માળું તે રસ્તે આવતા નથી.

દાંતાનું રાજ અને તીથ્

અહીંઆ હેરાસરો બંધાયા તે વખતે આ ભાગ ચંદ્રાવતીના રાજના તાખામાં હતો. અને શેઠ વિમળશાહ બાં રાજવહીવટ કરતા હતા. ગુજરાતના સોલંકી રાજ્યાને તે પોતાના મુગટ અમજૂતા. વિમળશાહ ચંદ્રાવતીમાં સોલંકી રાજના મંત્રી તરીકે વહીવટ ચલાયો. આ વાતની ગુજરાતના સોલ કી રાજ પહેલા લીમહેવને માહિતી મળતાં તેણે વિમળશાહને રાજચિહ્ન મોઝલ્યાં હતાં. વિમળશાહ પછી ચંદ્રાવતી પાછું અમૃત સાજ્યાના હાથમાં ગણું. તેઓ પણ ગુજરાતના રાજ-

આના ખંડિયા હતા અને આરાસાલુ એચોના^૧ તાણે હતું. જ્યારે અલાઉદીનતું લશ્કર ગુજરાત ઉપર ચઢ્યું અને આરાસાલુનો નાશ હચે તે વખતે અંધાધુંધીના સમયમાં રાજસુતાતું હંઈ કેકાલું રહ્યું નહીં.

દાંતારાજના વડવાઓ ઠંકુથી આવ્યા. તે ચૌદમા સૈધાની શરૂઆતમાં આવ્યા તે હકીકત અગાઉ દાંતાના રાજની હકીકતમાં આવેલ છે. મતવખ કે દાંતાના રાજકાળ પહેલાનાં આ હેરાસરો છે અને તેની આબુભાબુની જમીન પણ હેરાસરોને લગતી છે. કુંભારીયા ગામ પાછળથી વસેલું છે. દાંતાનાં રાજની સત્તા જમતી ગઈ તેમ તેમ આબુભાબુનો પ્રદેશ તાણામાં લીધો. દાંતાના સંધના હાથમાં કુંભારીયાનો વહીવટ હતો. સંધ દરખાર સાહેબની રૈયત હતી. તે અરસામાં હેરાસરોની આસપાસની ટેકરીઓ અને જમીન કે જ્યાં જૂના આરાસાલુનાં જમીનહોસ્ત થયેલા મકાનોની જૂની મોટી ઈટો વિગેરે મળી આવે છે તે તે ઉપર ધ્યાન હોશાયું હોય તેમ સંભવ છે.

શેઠ આલુંદળુ કલ્યાણલુના હાથમાં વહીવટ આંદ્યા પણી જ્યારે ધર્મશાળા અને કૂરાતું કામ શરૂ કરવામાં આંદ્યું ત્યારે રાજ તરફથી નહીં ઇચ્છિવાળેગ વિધન નાખવામાં આંદ્યું. શેઠ આલુંદળુ કલ્યાણલુની પેઢી તરફથી

૧ રાજબોઝી બાને ધારાવ્યંદેવ નામના પુસ્તકમાં ભાગ ૧થામાં આરાસાલુને આરસેશાર નામ આપેલું છે. પાતું ૪૨૧. વળી આ પુસ્તકની બદલા પહેલા પ્રકરણમાં ચંદ્રાવતીમાં તેરમા સૈધામાં પરોધ્યણ અને તેની પણી ધારાવ્યંદેવ નામના રાજ બધા અને તે ગુજરાતના રાજના તાણામાં હતા એમ બતાવેલું છે.

રાજ સાથે સારો સંખંધ જળવાય તેવી રીતે હરેક પ્રસંગે વર્તવામાં આવે છે પણ અમલહારોની અભિગીર્ણિને લીધે તીર્થની પ્રગતિ થતી નથી. શાંતિનાથના દેરાસરની દક્ષિણે એક મોટું પીપળાનું આડ છે. તેના નીચે એક માટે શિલાલેખ હતો તે સં. ૧૯૬૭ ની સાલમાં રાજના માતાજીના અમલહાર ઉપાડી ગયા. આ આખતની તકનાર પેઢી તરફથી ઠેઠ નામહાર રાણુાલુ હંજુર લેવામાં આવી અને શિલાલેખ પાછે આપવા નામહાર રાણુાલુએ હુકમ કર્યો પણ પેઢીના માણુસોની માગણી છતાં પાછે આપવામાં આવ્યો. નથી. ધર્મશાળા બંધાવવાની અને ઝૂંબો કરાવવાની જરૂર હોવા છતાં રાજની આવી ઉખ્લેથી તે બની શકતું નથી; માટે રાજની સાથે મળીને શેઠ આણુંદળુ કલ્યાણુણી અમદાવાહની પેઢીના પ્રતિનીધીએ એ દસ્તો કાઢવાની ખાસ જરૂર છે.

આ આરાસાણુ ડાઈં કુલારીયાલુનું તીર્થ પ્રાચીન ને પ્રલાઘિં છે. વળી દેરાસરોની કારીગરી લભ્ય અને સુંદર છે. ચારે તદ્દે પર્વતમાળા હોવાથી જગ્ગા પણ રમણીય જણ્ણાય છે. અને સુંદર ઠંડો પવન ઉનાળામાં પણ ચાલુ હોય છે. તેથી જાતાણુને આશામ અને શાન્તિ મળે છે. બની શકતી સગવડ થઈ છે. આ તીર્થ આખા હિન્દુસ્તાનના જેન શ્રેતાભર મૂર્તિપૂજક જૈનોનું છે. સારી રીતે ઉત્તરવાની સગવડ થાબ તેં જાતાણ ધણી માટી સંખ્યામાં આવે તેમાં રાજની પણ શોભા છે, માટે રાજ તરફથી તીર્થની ઉજ્જ્વિત થવાના કામમાં પેઢીને મફફ આપવી જોઇએ, નકામી ઉખ્લેલો હુર કરવી જોઇએ અને રાજના અમલહારોએ અને નામહાર મહારાણુા સાહેણે અડચણ્ણો ન નાખતાં સરલ અને ઉદાર મનથી સહૃદાર આપવો જોઇએ. તેમાં જ રાજની કીર્તિ છે. આ તીર્થ રાજની શોભારૂપ છે.



પરિશિષ્ટ

જૈન વાણીયાની ઉત્પત્તિ

શ્રીમાણી, પેરવાડ અને ઓસવાળ વાણીયા ઘણું ભાગે જૈન છે. શ્રી લાવણ્યસમયગણિતુંએ સં. ૧૫૬૮ માં “વિમલ-પ્રથ્રાંધ” રહ્યો છે તેના ખંડ ૧ લાભાં, કાંચ ખીજથી વાણીયાની ઉત્પત્તિ વિશે વિસ્તારથી વિવરણ કરવામાં આવ્યું છે, જે રચિક ને બાધુવા જેવું હોવાથી દૂંધામાં નીચે આપવામાં આવ્યું છે.

શ્રી લક્ષ્મીહેવી સત્યુગના વખતમાં એક વખતે શ્રી ઈન્દ્ર મહારાજની સભામાં ગયાં. ત્યાં ઘણું સન્માન પામી, ઈન્દ્ર મહારાજે આપેલી કદ્વપૃષ્ઠકાળ કૂતની માળા પોતાના કંડમાં ધારણ કરી પાછાં વળ્યાં ત્યારે રસ્તામાં આવતાં તેમણે માળા તૂટી પડતી બાણી. તેથી તેમણે અનુમાન કર્યું કે આ સ્થાન મહિમાવંત અને ઉત્તમ હેવું જોઈએ. પોતાના પરિવાર સાથે ત્યાં રોકાયાં અને હેવોને બોલાવી એક સુંદર નગર વસ્તાવવાનું કર્યું. હેવોએ તે જગ્યાએ મોઢું સુંદર નગર વસ્તાવ્યું અને તેનું નામ પુણ્યમાળા પાડયું. નગર વસ્તાવવાનું કામ પૂરું કરી લક્ષ્મી હેવી પરિવાર સાથે ૧૧-સ્થાનકે પદ્ધાયો.

તેતા યુભમાં હેવી પાછાં પુણ્યમાળ નગરે પદ્ધાયો તે વખતે તેણે પહેરેલ મણિ, માણ્ણેક અને હીરાનો હાર અચાનક તૂટી પુછ્છી ઉપર પડ્યો. દોકાને ઘણું રતનો અભયાં તેથી પુણ્યમાળ નામ બદલી રેલપુર નામ પાડયું. તે પછી દ્વારયુભ આવ્યો. હેવી વિમાનમાં બેસી નગરની

અથર હેવા આંદ્યાં, રાલાચો બહુ જ નમૃતાથી એ હાથ જેણી પ્રાર્થના કરી અને હેવીના ચરણમાં પડ્યો. પ્રલાંભ ભાવપૂર્વક અહિતા કરી, તેથી હેવીએ પ્રસંગ થઈ પોતાના કંઠની માળા નગરજનોને આપી. અને રત્નપુર નામ બદલી નગરનું નામ શ્રીશ્રીમાલ સ્થાપયું. નગરજનોએ લક્ષ્મીહેવીતું મહિર બંધાંદ્યું અને માળા શ્રીહેવીનાં કંઠમાં આરોપણ કરી. હેવીએ શ્રીશ્રીમાળા જાતિની સ્થાપના કરી.

આ શ્રીશ્રીમાલ નગરમાં કરોડપતિ હોય તે નગરના કોટમાં રહે અને ધીલ બહાર રહે એવી પ્રથા હતી. નગરમાં ઉહુડ અને રોહડ નામના એ લાઈ હતા. રોહડ કરોડપતિ હતો. ઉહુડ પાસે કરોડમાં એક લાખ ઓછા હતા તેથી કરોડની રકમ પૂરી કરવા તેણે એક લાખ તેના ભાઈ પાસે માણ્યા પણ તેણે આપ્યા નહીં તેથી ઉહુડને ઓદું લાંઘ્યું અને નસીબ અજમાવવા ધીજે રૂથળે જવાનો વિચાર કર્યો. રાલના પુત્રને તેના પિતા સાથે અણુઅનાવ થવાથી તે પણ રીસાઈ દેશાવર જતો હતો. તે ઉપલહેડુમાર સાથે ઉહુડ પણ નીકળ્યો. શુકન સારા થયા. લાંધી સુખાઝરી કરી તે સીંધમાં આંદ્યા. સીંધના રાલની રાજધાની નગરઠકુમાં હતી. તેને આ બંને જણુ મળ્યા અને રાલની સૂચના પ્રમાણે ઉજગડ પ્રફેશમાં જઈ, ઉચેસ નામનું નગર વસાંદ્યું. ઉપલહે ત્યાં રાલ થયો અને ઉહુડ તેનો પ્રધાન થયો. તેઓની આશા દુઃખિકૃત થઈ. તેના વેર એક ગાય હતી. તેનું દુખ જંગલમાં જરી જાય છે એમ ઉહુડને માલુમ પડ્યું તેથી તેની તપાસ કરવા તે જંગલમાં ચયો. જે જગ્યાએ દુખ જરી જતું જોવામાં આંદ્યું તે રૂથળે તપાસ કરતાં

શ્રી પાદ્મનાથ જિનેશ્વરની પ્રતિમા નીકળ્યાં. તે જ રાતે ઉહડને સ્વભનમાં શ્રી શચિહેવીએ આવીને કંધું કે-હું નગરનું રક્ષણું કરનાર દેવી છું. તને જે પ્રતિમાલ મદ્યાં છે તેમનું હેરું બંધાવ અને પાસે મારું મંહિર બંધાવ અને ઉસવંશની સ્થાપના કર. ઉહડે રાજને સધળી હક્કીકતા કહી અને મંહિર બંધાયાં, ઉસવંશની સ્થાપના કરી. ઉસવંશની પરંપરાવાળા ‘ઓસવાલ’ કહેવાયા.

આ બાજુ શ્રીમાલનગરમાં રાજ નખોએ પડી જવાથી લુંટદ્વારા વધી પડી તેથી નગરજનોએ પૂર્વના-પૌરવાચક-વર્તની મદદ મારી અને હસ હજાર સુભટોને તેડી લાવ્યા તેથી દોકાનો ભય ટળી ગયો. સુભટોએ શ્રીમાળ નગરની પૂર્વમાં વસવાટ ક્યો અને ત્યાં શ્રી અંબાલ માતાજીનું રથાન હતું તેથી અંબાલમાતાજીની લન્દિ-આરાધના કરવા મારી. તેઓએ પૂજા-ઓચ્છવ-મહેતખવ ક્યો. અંબાલમાતાલ તેઓના ઉપર પ્રસન્ન થયા અને વરદાન આપ્યું કે—“હું તમારી ખાંધે વસી તમારું રક્ષણ કરીશ.” સુભટોએ અંબાલમાતાજીને ગોત્રજ સ્થાપી. હેરું બમરાવી તેના ઉપર હંડ, કળશ અને ધવજ બડાયાં. આ સુભટો શ્રીમાળનગરની પૂર્વમાં વસ્યા માટે પ્રાગવાટ કહેવાયા. આ રીતે પોણવાડ શાતિની ઉમતી થઈ.

શ્રીશ્રીમાળનગરને લક્ષ્મી દેવીએ આપેલી બક્ષીઓ પાણી લેવાથી કલિબુગમાં તેનું બિજ્ઞમાલ નામ પડ્યું અને અસ્તારે તે નામથી પ્રસિદ્ધ છે. આ નગર હાજરમાં મારવાડમાં જેધ્યુર શાન્દળની હંદમાં છે.

વાણ્યા ચોરાશી નાતના કહેવાય છે. તેમાં ઉપરની શ્રીમાળી, ઓસવાલ, પોરવાડ સિવાય બીજુ નાતના વાણ્યા થયા તે જાતિનાં નામ નીચે પ્રમાણે છે-

અડાયતા, અડેર, અડાલ, કઠણોરા, કાકિલા, કપોળ, નાઈલ, નાગર, નાણુવાલ, મોટાલાડ, લાડુઆશ્રીમાળી, હાલર, હરસુરા, (હરસોલા), હુંબડ, શ્રીગોડ, આલોરા, જોગડા, ધાકડીયા, લડીયા, ભુગડા, પ્રદ્વાણ્યા, વિધુ, વાયડા, ગાંઝુ, અડાલજા, મોઢ, માંડલીયા, પંચમ, પુષ્કરા, જખુસરા, સુભટવાલ, મંડોવરા, અચ્છતિ, અચ્છતિવાલ, સુરહિયા, માથર, કંધોળ, કરહિયા, પોડાયાડ, સોરઠીયા, પદ્મિવાલ, મડાહડા, મંડાના, મેવાડા, વાલમ, છાવા, ચિત્રવાલ, વધેર, નરસંગુરા, સરખાડેર, ભુમા, નાગદ્રહં, અચ્વવાલ, બાખર, વધણુરા, (ધણુરા કે ધીણુરા), વૈસુર, અસ્થિકી, અષ્ટવહી, પદમોદકી, ચોલવાલ, નાઘેરી, તેરોઢા, સાચોરા, બાંડેરા, નેરાણા, નીમા, વધ્રીયા, કોરંટાવાલ, દાહિધ, સોનીસાથ, મયાલ, રાજશાખા, લધુશાખા, વાડીશાખા, બેશાખા, ચોશાખા, સુરાણ્યા, રાણુરા, મેવિતવાલ, સુડેરા, આણુહોરાં *

અઢાર વણું કહેવાય છે, તે નીચે પ્રમાણે છે

ધ્રાદ્ધાણ્ય, ક્ષત્રિય, વૈશ્ય, શૃદ્ધ, કંદોઈ, કાણીયા, કુંભાર, માળી, મર્દનિયા, સુતાર, લેસાઈત, તંધોળી, સોની, ધાંચા, છીપા, લુહાર, મોચી, ચ્યમાર. આ રીતે અઢાર વણું છે.

* વાણ્યા ચોરાશી જાતિના કહેવાય છે, પણ ઉપર ને નામ અતોંબાં છે તે ગણ્યતાં ૭૧. થાય છે. તેમાં સુખ્ય બીમાળી, ઓસવણી, પ્રાજવાટ નષ્ટ મેળવતાં ૭૪ થાય છે. વિમળપ્રાંખમાં ને લખેલું તે પ્રમાણે અર્દી જાતિનાં નામ લખેલા છે.

[શ્રી કુંભારીયાળમાં પાંચ જિનાલયોમાં જે ને
મુણનાથક ભગવંતો છે, તેમના સ્તવનો ભાવિકોને
ઉપયોગી થયે તેમ ભાષી પ્રાચીન સ્તવનો આપ-
નામાં આવે છે.]

શ્રીખદ આનંદધનાલકૃત

શ્રી ઋષભહેવ જિન સ્તવન

(રાત્મ માર્દ-પરીક્ષાની દેશી.)

ऋષભ જિનેશર પ્રીતમ માહરો રે, ઓાર ન ચાહું રે કંત;
રીજયો સાહેબ સંગ ન પરિહરે રે, બાંગે સાદી અનંત. ઋ. ૧
પ્રીત સગાઈ રે જગમાં ચહું હરે રે, પ્રીત સગાઈ ન ફોય;
પ્રીત સગાઈ રે નિરૂપાધિક ફણી રે, સોપાધિક ધન ઘોય. ઋ. ૨
કોઈ કંત કારણું કાણશક્ષણું કરે રે, મહથું કંતને ધ્યાય;
એ મેલો નવી ઠાંબવે રે, મેલો ઠામ ન ઠાય. ઋ. ૩
કોઈ પતિરંજન અતિ ધંદો તપ કરે રે, પતિરંજન તલ તાપ;
એ પતિરંજન મેં નવી ચિત્ત ધંદું રે, રંજન ધાતુ મિલાપ. ઋ. ૪
કેદું કહે લીલા રે અવખ અવખતણી રે, વખ પૂરે મન આથ;
દેખ રહિતને લીલા નવી ધટે રે, લીલા દોષ વિલાસ. ઋ. ૫
ચિત્ત પ્રસન્ને રે પૂજન ઝલ છણું રે, પૂજા અખાંડિત ચેહ;
દ્વાપટ રહિત અઈ આતમ અર્પણા રે, આનંદધન પદ રેહ. ઋ. ૬

શ્રી યશોવિજયલુ ઉપાધ્યાયકૃત સ્તવનો

શ્રી નાથભદેવ જિન સ્તવન

જગળુવન જગવાલહો, મહેવીનો નંદ લાલ રે;
 સુખ હીઠે સુખ ડિપને, દરિશન અતિહિ આનંદ લાલ રે. જગો ૧
 આંખડી અંખુજ પાંખડી, અષ્ટમી શશી સમ લાલ લાલ રે;
 વહન તે શારદ ચંદ્રદો, વાણી અતિહિ રસાલ લાલ રે. જગો ૨
 લક્ષ્મણ અંગે વિરાજતાં, અડહિય સહસ ઉદ્ઘાર લાલ રે;
 રેખા કર ચરણાહિકે, અ઱્યંતર નહિ પાર લાલ રે. જગો ૩
 ધંદ્ર અંદ્ર રવિ ગિરિષણા, શુણુ લઈ ધડીયું અંગ લાલ રે;
 ભાગ્ય કીહાંથકી આવીયું, અચરિજ એહ ઉતાંગ લાલ રે. જગો ૪
 ગુણુ સધળા અંગીહ્યાં, હૂર કથ્યાં સવિ હોષ લાલ રે;
 વાચક યશોવિજયે શુદ્ધયો, હેને સુખનો પોષ લાલ રે. જગો ૫

શ્રી શાંતિનાથ જિન સ્તવન

(શ્રી જ્યાનંદ કુમાર-એ દેશી.)

ધન્ય હિન વેલા ધન્ય ધડી તેહ
 અચિષાનો નંદન જિન યદિ કેટશુંલુ;
 લહીશું રે સુખ હેખી સુખ ચંદ
 વિરહ વ્યથાના ફુઃખ સવી મેટશુંલુ. ૧

ભાડ્યો રે જેણે તુજ શુષ્ણુલેશ,
ઝીલો રે રસ્તેહને મન નવી અમેલુ;
ચાઢ્યો રે જેણે અમી લવલેશ,
આકસ બુકસ તસ ન ફૂચે કિમેલુ. ૨

તુજ સંમહિતરસ સ્વાદનો જાથ,
પાપ કુમતને બહુ હિન સેવિયોલુ;
સેવે જે કર્મને યોગે તોહિ,
વાંછે તે સંમહિત અમૃત ધુરે લિખયુંલુ. ૩

તાર્દં ધ્યાન તે સંમહિત રૂપ,
તેહજ જ્ઞાન ને ચારિત્ર તેહ છે લુ;
તેહથી રે જાયે સધળાં પાપ,
ધ્યાતા ધ્યેય સ્વરૂપ હોયે પણેલુ. ૪

હેખી રે અદ્રશુત તાહડં રૂપ,
અચરિજ જાવિઠ અરૂપી પદ વરેલુ;
તાહડી ગત તુંહી જાણે હો હેવ,
રમરણ ભજન તે વાચક અશા કરેલુ. ૫

શ્રી પાર્થીનાથ જિન સ્તવન

(રામ મહાર)

વામાનંદન જિનવર, મુનિવરમાં વડો રે કે મુનિવરમાં વડો,
કિમ સુરમાંડે સોડે સુરપ્રતિ પરવડો રે કે; સું

જિમ ગિરિમાંડે સુરાચલ, મૃગમાંડે કેચરી રે કે,	મૃ૦
જિમ ચંદન તહુમાંડે, સુભટમાંડે સુર અરિ* રે કે. સુ૦ ૧	
નહીંમાંડે જેમ ગંગા, અનંગ સ્વરૂપમાં રે કે,	અ૦
કુલમાંડે અરવિંદ, ભરતપતિ ભૂપમાં રે કે;	અ૦
ઔરાવણુ ગજમાંડે, ગડડ ખગમાં યથા રે કે,	ગી૦
તેજવંતમાંડે બાણુ, વખાણુમાં જિનકથા રે કે. ગી૦ ૨	
મંત્રમાંડે નવકાર, રતનમાંડે સુરમણુ રે કે,	૨૦
સાગરમાંડે સ્વયભૂ-રમણુ શિરોમણુ રે કે;	૨૦
શુક્લધ્યાન જિમ ધ્યાનમાં, અતિ નિર્મલપણુ રે કે,	અ૦
ઓ નયવિજય વિષુધ્યપથ-સેવક ધ્યમ બણુ રે કે. સે૦ ૩	

શ્રી મહાવીર જિન સ્તવન

જિંડા રે શુણુ તુમતણુ, ઓ વર્ધમાન જિનરાયા રે;
 સુણુતાં શ્રવણુ અમી જરે, માહરી નિમંલ થાયે કાયા રે ॥ ગી૦
 તુમ શુણુ ગણુ ગંગાજલે, હું ઓલીને નિર્મલ થાઉં રે;
 અવર ન ધર્ઘો આદર્દે, નિશદિન તોરા શુણુ ગાઉં રે ॥ ગી૦
 ઓદ્દયાં જે ગંગાજલે, તે છિદ્રૂર જલ કેમ પેસે રે;
 જે માતતી કૂદે મોહીયા, તે બાવલ જઈ નવી પેસે રે ॥ ગી૦
 એમ અમે તુમ શુણુ ગોઠશું, રંગે રાચ્યા ને વળી માચ્યા રે;
 તે કેમ પરસ્ફુર આઠરે, જે પરનારી વશ રાચ્યા રે ॥ ગી૦
 તું અતિ તું મતિ આશરો, તું આલંખન સુજ ખ્યારો રે;
 વાચક થશા કહે માહરે, તું લુલન લુલ આધારો રે ॥ ગી૦

* મુરારિ-કૃષ્ણ

प्रामिस्थान

मथुरहास छगनलाल शेठ
वाराशेरी, सावनगढ़
रत्नलाल केशवलाल शाह
प्रांतिज